

આદ્વારી ૫ કર્તૃ

અનુષ્ઠાનિક પ્રસાદથી માટેલાં કાર્યાલાય

માટેલાં

અનુષ્ઠાનિક પ્રસાદથી માટેલાં



ॐ

મા

ॐ

ॐ

મા

ॐ

ॐ ભર્ગયઃ સ્વા: ॐ તત્ત્વિતુર્યર્થા ભર્ગદેશય
દીપાદિ: ॥ ધિરો યીતઃ પ્રયોદ્યાત-ॐ ॥

૩. રાજ્યોદી નં.૧૨૩

અનુષ્ઠાનિક પ્રસાદથી માટેલાં કાર્યાલાય પ્રસાદથી માટેલાં કાર્યાલાય ૫૦ ॥

॥ॐ મા ઓમ્॥



*
વાર્ષિક લવાળમ
ઝિપિયા દસ

*

: પ્રકાશક .

શ્રી કેલાસઅહેન એન. પરીખ,
શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ,
'નીલોપા' અંગલો, ત્રિમુનિં
મોસાયટી, ગવર્નમેન્ટ પાંચ
અંગલા પાસે, ગુરજારાઈ ૨૬૨૩,
અમદાવાદ-૩૮૦ ૦૧૫

*

: મુદ્રક :

કાન્તભાઈ મ. મિશ્રી
આદિત્ય મુદ્રણાલય
રાયખણ
અમદાવાદ - ૩૮૦ ૦૦૧

ગ્રાંડયાત્રિક કેરી

શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ : અમદાવાદ ૩૮૦ ૦૧૫

વર્ષ ૧૫]

* એપ્રિલ-૧૯૯૫ *

[અંક ૧

અનુકૂળખાડા

અદાર આયુધોથી શાંતિ યુદ્ધ જેલતા રાજ્યોગી	...	૧
વિશ્વા સંસાર સમરાંગણું રાજ્યોગી		
— સમાદરતાનો સંદેશ	સતીશભાઈ ભડુ	૩
‘દિન્ય ઔપધિ’ પ્રદાન	...	૪
રાસરામેશ્વર રાજ્યોગી જન્માભીમીએ...	...	૫
ધર્મિયાળના કંઠે	...	૧૬
તમે કચાં જીભા કો ?	...	૮
જીનગોઢી	...	૧૦
શાંતિ	...	૧૪
શાંતિ-પ્રશ્નોતરી	...	૧૬
આર્થ સંસ્કૃતિનું પુનર્સ્થાન	...	૨૨
ધનિકોને લાલઅત્તી	...	૨૪
નવરાત્રીની અધ્યમીએ પ્રત્યક્ષ ઉપસ્થિતિનો		
અહેસાસ કરાયો	...	૨૭
સૂતરતા તાતંણે રેલટાઈલ માર્કેટમાં ગાયત્રી મહાયજ	...	૨૯
પ્ર. રાજ્યોગીનો અમેરિકનો કાર્યયજ - મે-જૂન ૧૯૯૬	...	૩૧
પ્ર. રાજ્યોગીનું ઈંગ્લેન્ડ-અમેરિકનો કાર્યયજ -		
ઓગસ્ટ ૧૯૯૬	...	૩૨
નિત્ય-સમરાષ્ટ	મુંનલલ દવે	પ્રંદું ૩
સમાચાર		પ્રંદું ૩



આધ્યાત્મિક કેડી
વર્ષ ૧૫ : એપ્રિલ ૧૯૮૬
ખ

અઠાર આયુધોથી શાંતિ ચુદ્ધ ખેલતા રાજ્યોગીજ

ત૪. ૧૭-૨-'૮૬ શનિવારે મહાશિવરાત્રિની સંધ્યાએ 'અદ્ધ' કુટિરમાં ભક્તોની લિડ જામી હતી. જેના 'રોમેરોમાં "કુ" "ખ" એમ, સ્વસ્તિક એવા એમકારેખર કલ્યાણુકારી ચિહ્નો દેખાય છે; તેવા રાજ્યોગીજના દર્શન કરી ધન્યતા અનુભવવાની એક અભિપ્રાસા ભક્તોમાં હોય તેમ વરતાતું હતું.

આને પૂન્ય રાજ્યોગીજનો સેવાયજ યૌવનમાં પ્રબેશી વધુ ગહન અને અલોકિક માનવ કલ્યાણના શિખરો સર કરી રહ્યો છે.

આજના શુભ પ્રસંગે પૂન્ય રાજ્યોગીજ પોતાતું વક્તવ્ય આ પ્રમાણે રજુ કરે છે :

“પ્રવેશ આપ્યો માટે, આધ્યાત્મિકતાના સંશ્લામમાં
આપ્યું” આયુધ મોતી તણું, વિશ્વના સમરાંગણુમાં
ઘેલી રહ્યો છું ચુદ્ધ અઠાર આયુધો થકી.

માતાજીએ ગઈ તા. ૧૧-૩-'૭૫ની મહાશિવરાત્રીના દ્વિસે મને મોતીની માળા પહેરાવી ને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રવેશ આપ્યો. સંસાર સમરાંગણુમાં લડવા માટે મને આયુધ તરીકે મોતીની માળા આપી.

માતાજીએ મોતીની જ માળા શા માટે આપી? રુદ્રાક્ષ, સ્ફુરિક, તુલસી વગેરેની માળા નહિ? મારા મત મુજબ મોતી પવિત્ર ગણ્યાય છે. સરેદે રંગ શાંતિનું પ્રતીક છે. સરેદે પ્રકાશ અંધકારને દૂર કરે છે.

માળાના મળુકા ૧૦૮ અને મેરુ થઈને ૧૦૮ થાય. આ ૧૦૮ મળુકામાં ૧૮ મારાં આયુધો છે. જેવાં કે—

વડુરિપુનાં છ આયુધો,
નવ સિદ્ધાંતોના નવ આયુધો
મન, વચન, કર્મની પવિત્રતાનાં પ્રણ આયુધો.

— એમ કુલ ૧૮ આયુધો છે.

મારી સાથે તમે બધાં એહાં છો, અથવા તો મારી પાસે મુલાકાત માટે જે કોઈ વ્યક્તિ આવે છે તેને તેની અંગત વ્યથા હોય છે. દરેકની વ્યથા જુદી જુદી હોય છે. હવે આ વ્યથાને સુલજાવવા માટે મારે સંસારના સમરાંગણુમાં ઝંપલાવવું પડે છે.

માતાજીએ મને મોતીની ભાગા પહેરાવીને સંસાર સમરાંગણુમાં પહોંચાડી દીધા છે. આ સંસાર સમરાંગણુમાં આધ્યાત્મિક યુદ્ધ ખેલતો ખેલતો આજે હું બાવીસમા વર્ષમાં પ્રવેશ કરું છું.

આવીસ વર્ષથી મોતીની ભાગામાં મહુકાડપે ગોઠવાયેલા ૧૦૬ની વ્યૂહરચના આ પ્રમાણે છે:

૧૮ મારાં આયુધો :

ક પદ્ધરિપુનું નિયંત્રણ, ત મન, વચન, કર્મની પવિત્રતા, દ સિદ્ધાંતો,
૬૦ મારા સંત્રીએ / સૈનિકો અને ૧ મેરુ સમા સેનાપતિ - મા ભગવતી

૬૦ સંગીએ એટલે - અગાઉ મારામાં અને માતાજીમાં જેમને અદ્વા છે તેવા એ ટકાં લોકોનો
મેં ઉદ્દેખ કરો હતો. આ એ ટકામાં આવતા લોકો મારા ૬૦ સંત્રીએ / સૈનિકો છે.

આમ મોતીની ભાગામાં ગોઠવાયેલાં આધ્યાત્મિક આયુધોથી સંજ્ઞ હું વિશ્વના સંસાર સમરાં-
ગણુમાં સાત્ત્વિકતા, નૈતિકતા અને માનવતાને પ્રસરાવવા અને અંધઅદ્વાને વિદ્વાવાનું યુદ્ધ ખેલી રહ્યો છું."

ઉપરોક્ત વચનો પૂ. શ્રી રાજયોગી નરેન્દ્રાંજી તેમના નિવાસસ્થાન 'અદ્વા'ના પ્રાંગણુમાં તેમની
આધ્યાત્મિક દ્વિદ્શાખ્દી મહોત્સવના સમાપ્તન સમારંભમાં ઉચ્ચાર્યા હતા.

આ પ્રસંગે પૂ. રાજયોગી નરેન્દ્રાંજી આધ્યાત્મિક દ્વિદ્શાખ્દી અભિવાસન ચંચ 'વિદ્યના સંસાર
સમરાંગણુમાં' તેમ જે 'સંચોણ રાજયોગી' ને માત તણોની વીડિયો ક્રેસેટનું મંગળ પ્રકાશન
પૂ. પરસનાયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

પૂ. પરસનાયાની 'અદ્વા'ના પ્રાંગણુમાં પધરામણી થઈ ત્યારે સમગ્ર વાતાવરણુમાં અનોખી
અલ્લોકિતતા પથરાઈ ગઈ હતી. સૌચે તેમનો જ્યયકાર કરો હતો અને તાળાએના ગડગડાએથી
વધાવી લાધાં હતાં. સરેદ વખો પરિધાન કરેલાં પૂ. બાયે સુગર અને ગળામાં મોતીની ભાગાથી
ઓપતાં હતાં. તેચો પૂ. શ્રીની બાજુમાં ડિંચદ પર બિરાજમાન થયાં ત્યારે રાજમાતા તરીકે તેમનો
જ્યયકાર થયો હતો. તેમણે આશીર્વાદ ઓપતાં કહ્યું : " સૌને મારા અંતરના આશીર્વાદ છે."

કાર્યક્રમના અંતમાં ભાઈશી સુંઝલે તાંડવ નૃત્યની સરસ જલક રજૂ કરી હતી. સમગ્ર માહૌલ
આશ્ર્યચક્ષિત અને ભાવવિભોર અની ગયું હતું. પૂનય રાજયોગીનું પણ તાંડવનૃત્યની આ જલકમાં
પોતાની આગવી જલક ઉમેરી સમગ્ર વાતાવરણ કેલાસમય બનાવી દીધું હતું.



પૂજય ગુરુદેવનો સુંબદ્ધનો કાર્યચઙ્ગ

* તા. ૬-૪-'૬૬ થી ૭-૪-'૬૬ શનિ-રવિવાર

* સમગ્ર : બપોરે ૧૨-૦૦ થી ૪-૦૦ * સ્થળ : જેણ/૮૧, જેણી નારણુદાસ લક્ષ્મીદાસની
વાડી, એચાબનાર, ફોર્ટ, સુંબદ્ધ ૪૦૦ ૦૦૧

* તા. ૮-૪-'૬૬ 'નિલોખા' સુલાકાત બંધ. તા. ૬-૪-'૬૬ 'નિલોખા' સુલાકાત ચાલુ.

વિશ્વના સંસાર સમરાંગણુમાં રાજ્યોણી સમાદરતાનો સંદેશ

સતીશલાઈ લલુ

કુ ઈ એવી વિશિષ્ટ આકૃતિ ધડતી વેળાએ વિશ્વના કુંભકરને પણ થોડી પણો વિમાસણુની હોય છે. આ કૃતિને ૩૫-ગુણુના સલાટી-ટપલા મારતાં, તેને થાય છે કે આ ટપલા તેને કર્મના કે જગત સાથે ટક્કર લેવાના સંધર્થના મારું છું. તેતું એક મન એમ કહે છે કે આ તો મારું જ સ્વરૂપ છે અને બીજું મન એમ કહે છે કે ભલે મારું સ્વરૂપ છે પણ તેને હું માનવી તરીકે જગતમાં મોકલી રહ્યો છું. છતાં ય એક ચોક્કસ નિષ્કર્ષ તેનો છે કે આ 'મારું' માનવીય સ્વરૂપ કર્મના કે જગત સાથેના સંધર્થોમાંથી નીપજતાં સુખ-દુઃખ, જ્ય-પરાજ્ય કે લાભ-અલાભની અસરો કે અનો-વેદ્ધનાઓથી પર છે-અસરમુક્ત છે તે કર્મ વગરનો રહી નહીં શકે પરંતુ ઇણના ભાવથી મુક્ત હશે.

જ-વ-ન. જીવ માત્ર શરીરી ઘનતાં, દેહી ઘનતાં જગતની સાથે સંબંધે જોડાય છે. જગતમાં તો આવવું જ પડે છે. અહીં કર્મવાદનો ઉદ્ય થઈ ચુક્કો છે. પૂરા ધરોણા સાથે ઘટના ધરે છે-જીવનની કર્મ-સંધર્થ બહુ પાસે જીબેલા છે. ભેદરેખા બહુ પાતળા છે. શરીર ધર્મો અને મન ધર્મો બનેના જન્મ નામ પડતાંવેંત જ પ્રારંભ થઈ ચૂકે છે. સ્વીકાર કરો કે નહિં, સ્વયં ઈશ્વર પણ સાકાર થાય ત્યારે, તેને સંધર્થ જેલવો જ પડે છે. સંધર્થ જગતનો સ્વભાવ છે. માનવી તેમાં અંતર્ગત થયો એટલે સંધર્થનો સ્વીકાર તેને કરવો જ રહ્યો. તેનો કોઈ પર્યાય નથી. ગીતાએ કર્મને તેથી તો ધણું જ સ્પષ્ટ કર્યું છે. પાર્થ કર્મ વિના જીવી ના શકત. જીવન ગુંચવાડો ત્યારે સર્જે છે જ્યારે મૂઢતા પ્રવર્તે છે. ભલે એ દુર્યોધન છે પરંતુ તેનો મૂઢતાનો સ્વીકાર સાચો છે- ધર્મને જણવા છતાં તેનો સ્વીકાર ના કરી શકાય અને અધર્મને જણવા છતાં તેનો ત્યાગ ના થઈ શકે. રાજ્યોણીનો આ જગતમાં 'સંભવ' આ બધી ધટનાના પરિપ્રેક્ષ્યમાં અતિ મહત્વનો છે. ધર્મ સંસ્થાપનાર્થી સંભવામિ યુગે યુગે ! કેટલાક જીવનને (જીવનભવ) સાગર કહે છે. કેટલાક ભવાડવિ (જગત) કહે છે, તો કેટલાક તેને સમરાંગણુ-વિશ્વ સમરાંગણુ. ઉપલબ્ધિએ સમજવા જેવી છે. રાજ્યોણી જ્યાં જીભા છે, જેવા પણ જીભા છે અને જે કંઈ કારણુ-વશાત્ જીભા છે તે કુદુકેત, તે વિશ્વ સમરાંગણુમાં તેમની છટાધારી જેવી છે તે મહત્વપૂર્ણ છે. કૃષ્ણ કે રાજ્યોણી હથિયારધારી નથી, અખતરધારી નથી, અને જણ કોઈની સાથે લડવા આવ્યા નથી- છતાં ય યુદ્ધને જુઓ છે, માણે છે અને યુદ્ધ જીતાડે છે. અનેના હોડો આણુધાર્યું સિમત છે, યુદ્ધભૂમિ પર હોવા છતાં તેમના મનમાં યુદ્ધ નથી. અને અને અને અને એને યોગ્ય હોય છે. અગર જે તેમની પાસે હથિયારો છે તો કેવળ નવ સૂત્રો - નવ જીવન સિદ્ધાંતો, જે થડી અન્યને માટે જીવવું, અન્યને જીવાડવા. પરિત્રાણાય સાધૂનામું ! અને એવી હસ્તીએ છે કે જેમના સાનિધ્યમાત્રથી યુદ્ધ આસાન બની જય. યુદ્ધભૂમિને વજભૂમિમાં પરિવર્તિત કરે તે રાજ્યોણી. વિષને પ્રેમરસમાં પરિવર્તિત કરે તે રાજ્યોણી. તેમના જ શફ્ફોના સાર ઇયે ઝું તો - 'મોત પણ આવે તો કહી દ્વિં કે મિલકત પરાઈ છે.' માતૃશરણે સર્વસ્વ નોંધાવર. તેમનું સારું ય જીવન શ્રદ્ધા-શરેણુગતિતું અલગ સ્વરૂપ છે.

આધ્યાત્મિક ડેડી, એપ્રિલ, '૬૬]

હુને, તો, પ્રશ્ન એ ઉલ્લેખ રહે છે કે રાજ્યોગી વિશ્વ સમરાંગણુંમાં શાથી? તે કોઈ શત્રુ નથી, કોઈ તેમનું શત્રુ નથી, તેમની પાસે હથિયાર નથી, તેમને-જગતની પાસે કોઈ લેણુદેણુનો હિસાબ પતાવવાનો નથી છતાં જગત સમરાંગણુંનું નકારાતમક વિશેષણું કેમ સ્વીકારે છે? પરમ પોતે જ માત્રભાવે, પિતુભાવે, સખાભાવે, બંધુભાવે અને આપ્તજ્ઞભાવે સામે જલ્દું છે. રાજ્યોગીને અનુભવસિદ્ધ કરવા પ્રમાણભૂત બનાવવા, જગત અસારતા, આમકારા, નિરસતાનો ડાસ પુરાવો છે તેવું સિદ્ધ કરવા તેમનો અત્રે સંધર્ષ છે. જગતની સર્વ સેવા કરીને સ્વને સંપૂર્ણ ‘અકર્મ’ બનાવવો તેવો મકસદ પરમ તચ્ચના પરમ જ તેમના સદ્ગુરુ છે. તેમની મર્દાનગીનું હર ઘડી માપ લીધા કરે છે. સત્યની શાધ્ય શું? પ્રેમની શી પ્રસ્તાવના? કેવળ અહોભાવ. વિશ્વ સમરાંગણુંમાં વિશ્વરૂપ દર્શાન નેચો. આપી રહ્યા છે—સૂર્ય, શાખા અને સ્વરૂપ સધળાં જ્યાં તેમનામાં વિલીન થઈ નથ્ય છે.

તો, રાજ્યોગીની, સમરાંગણુંમાં ઉભેદા રણધીરની જિંદગીને જોવી, વિસમયપૂર્વક નિહાળી એક કણ છે, આત્મસૂઝ છે. આશ્ર્યથી નહિ—આશ્ર્ય તો ભૌતિકવાદી, વિજ્ઞાનવાદી છે. તે તોડકેડમાં અને પુનઃ જોડાણુંમાં માને છે. વિસમયમાં તો તમે જ રહેતા નથી કેવળ રાજ્યોગી રહે છે. તમે બોવાઈ જઈને, તમારી અસ્તિત્વાને ઓગળીને, તમારા સમય અસ્તિત્વના આકારને તાડીને જીભા રહેવું, તેમનું દ્શાન કરવું અને માણવા એવી તમારી પ્લેને કામે લગાડવી તે વિસમય છે. વિસમયમાં માનવી હસી શકે છે, રડી શકે છે, બોલી નથી શકતો, વિચારી નથી શકતો. રાજ્યોગીને વિચારવાના નથી હોતા, માણવાના હોય છે.

હેરણુધીર! સરકાર! વિશ્વ સમરાંગણુંમાં આપ ને કોઈ પદ્ધતિધર છો તો ભલે, પરંતુ અમે પણ જીબે—હુર્મોધનોની સામે, હુશાસનોની સામે, શકુનિયોની સામે, જરાસંધોની સામે. ત્યો આ અમારી લાકડાની તલવારો આપને ચરણે અને શરણે ધરી દઈએ છીએ. અમારી પાસે પાર્થનું જ્ઞાન નથી, જ્ઞાન નથી, શક્તિ નથી કે સામર્થ્ય નથી શાખતું. ઝૂપા કરો કે અમે આપના વિરાટત્વમાં સમાઈ જઈએ.



‘દિવ્ય ઔષધિ’ પ્રદાન

તી. ૧૪-૬-૬૫ સવારે ૬-૧૫ વાગે પૂનલ દરમિયાન માતાજીએ નીચે પ્રમાણેના પ્રવર્તમાન ગ્રાણુધાતક રોગોની દિવ્ય ઔષધિ અંગે માર્ગદર્શન આપ્યું :

કેન્સરના રોગ માટે	— પ્રાણુષધિ	ફલડ પ્રેશર માટે	— રક્તૌષધિ
ડાયાભીટીસના રોગ માટે	— મધૌષધિ	એઈડિસ માટે	— કામૌષધિ
હૃદય રોગ માટે	— શિવૌષધિ		

ઉપરોક્ત બિમારીથી પીડાતા દરદીએ ‘દિવ્ય ઔષધિ’નું સેવન કરવાની ધ્યાન હોય તો બિમારી અંગેનો ડેક્કટરનો રીપોર્ટ કે લેખોરેટરીનો રીપોર્ટ નિશાન માટે લાવવો જરૂરી છે.

આ ઔષધિ મા ભગવતી તરફથી પ્રદાન થયેલી છે. અતિ મૂલ્યવાન છે. આ ઔષધિ પૂનય રાજ્યોગીની મુલાકાત દરમિયાન ‘નિલોષા’ પરથી જ મળી શકશે. અન્ય સ્થળે મુલાકાત દરમિયાન આ ઔષધિ મળી શકશે નહિ.

આ ઔષધિની સાથે સાથે પૂનયશ્રીના અન્ય આદેશોનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

રાસરાસેશ્વર રાજ્યોગીલ જન્માષ્ટમીએ....

દ. સ.

૧૯૮૫ના ઓગસ્ટની એ અદારમી તારીખ હતી. વિઠળ સંવત ૨૦૫૧ના આવણ
વદ આડમનો એ દિવસ એટલે જન્માષ્ટમી. શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. અગાઉના
વર્ષે શ્રીકૃષ્ણની રસમય ગોપિત વાતો રજુ કરી ચૂકેલા રાજ્યોગીલ પાસેથી સૌને કૃષ્ણ જન્મોત્સવની
અવનવી રસલહાણ લૂંટવાની અપેક્ષા હતી, પણ કોણું જાણે કેમ, પૂંછા કરનાર સૌને જન્માષ્ટમી નિમિત્તે
પોતે કોઈ ઉત્સવ કરનાર નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હતું ને પોતે પોતાની ભક્તીમાં મસ્ત હતા.

જન્માષ્ટમીના દિવસે અપોરે તેઓનો મિનાજ અચાનક બદલાયો. તેઓ કૃષ્ણમય બની ગયા અને
તેમણે કૃષ્ણના વ્યક્તિત્વને-કાર્યને નિજની ધાનીમાં વાચા આપ્યો, જે આ પ્રમાણે હતી :

“શ્રીકૃષ્ણ યશોધાનો લાલો, સુદ્ધામાનો મિત્ર, બલરામનો ભાઈ, પાંડુનો તારણહાર, ગોપીઓના
જિગરનો હુકડો, બાલ સખાઓનો સાથીદાર, કંસનો દુષ્મન, મહાભારતના યુદ્ધના મેદાનમાં ગીતા
વહેવડાવનાર એક યુગપુરુષ.”

આમ શ્રીકૃષ્ણના જીવનનાં જુદાં જુદાં પાસાંએને તપાસીએ તો દરેક વખતે શ્રીકૃષ્ણ આપણને
જુદા જુદા લાગશે. કચારેક વિરાટકાય તો કચારેક વામન, તો કચારેક ધાળચેષ્ટા તો કચારેક સામાન્ય
માનવીનો દેખાવ. આ બધાં મહાનપુરુષોનાં લક્ષણો છે.

હજારો સાલો વીતી ગઈ, કંઈક રાજ-મહારાજાઓ આવ્યા ને ચાલ્યા ગયા, કંઈક સહતનતો
બદલાઈ ગઈ. ઇકતા ધર્તિહાસે જ નોંધ લીધી. દ્વારિકાનો મહારાજ શ્રીકૃષ્ણ આજહિન લોકહૃદે ઝૂલતો રહ્યો.
આની પાછળનું એક જ કારણ છે કે શ્રીકૃષ્ણ આપ્યો જિંદગી લોકોને પ્રેમ આપ્યો છે. જ્યારે લોકોને
રક્ષણું જોઈએ ત્યારે રક્ષણું આપ્યું છે. જુયો તેમની આપ્યી જિંદગી બાળપણું દ્વારિકાના મહારાજાન
સુધીની – તો જણાશે કે તેમણે પ્રેમ અને રક્ષણને જ આગળ ધર્યાં છે. તેમના સમસ્ત જીવનમાં અને
અસ્તિત્વમાં પ્રેમ જ હતો, જેથી આજે પણ તેઓશ્રી પ્રેમલક્ષ્ણા ભક્તિથી જ પૂજય છે.

રાજ્યોગીએ પણ તમો બધાંને શું આપ્યું છે ? શા માટે તમો બધાં આવો છો ? આની પાછળ
પણ પ્રેમ જ છે ને ! મેં તમને બધાંને અલૌકિક પ્રેમની સાંકળથી બાંધી દીધા છે ને તે પ્રેમ તમોને
અને જેંચી લાવે છે. માટે આવો, આજે જન્માષ્ટમી છે તો શ્રીકૃષ્ણના પ્રેમરસતું ખાન કરીને કૃતાર્થ
થઈએ.

શ્રીકૃષ્ણના પ્રેમરસમાં તરણેળ બનીને તેમણે એક ધૂતની રચના કરી, જે અને પ્રસ્તુત છે :

“જ્ય જ્ય શ્રીકૃષ્ણ વહાલા, યશોધાનો લાલો, જ્ય.....

યશોધાનો લાલો વહાલા, ગોપીઓનો ખારો, જ્ય.....

ગોપીઓનો ખારો વહાલા, દ્વારિકાનો રાજ, જ્ય.....

આધ્યાત્મિક ડેડી, અપ્રિલ, '૬૬]

૨

૫

દ્વારિકાને રાજ વહાલા, મોરપીંછધારી, જય.....
 મોરપીંછધારી વહાલા, લક્ષ્ણોને જિગારી, જય.....
 લક્ષ્ણોને જિગારી વહાલા, 'શ્રુત્સ'માં પધારિયાં, જય.....
 'શ્રુત્સ'માં પધારિયા, હિંચકે બિરાજિયા, જય.....
 હિંચકે બિરાજિયા વહાલા, પ્રેમરસ ઢેળે, જય.....
 પ્રેમરસ ઢેળે વહાલા, લક્ષ્ણો ઘેલા અને, જય.....
 લક્ષ્ણો ઘેલા અને વહાલા, રાજયોગી સંગે, જય.....
 રાજયોગી ઓલે વહાલા, કૃષ્ણ ઠનેયા જય....."

આ ધૂન તેમણે ધરનાં સહ્યો સમક્ષ ગાઈ. સાંજે 'શ્રુત્સ' કુટિરમાં અનપેક્ષિત અને આકસ્મિક કાર્યકુમ ચોઝાઈ ગયો. આ કાર્યકુમનું પૂર્વ આયોજન હતું જ નહિ, કાઈને ખખર હતી જ નહિ, પૂ. શ્રીએ તો સૌને ના જ કહી હતી, પણ અણુધારી આવી ચટેલી કૃષ્ણમય મસ્તીએ ઉત્સવતું ઇપ લીધું. અને એએ હાજર હતા તેએને તેનો લાભ મળ્યો. એ કૃષ્ણમય મસ્તીનો મિનજ અનુભવવા મળ્યો. તેમણે રચેલી ધૂન 'શ્રુત્સ' કુટિરમાં ગાઈ-ગવડાવી. પોતે રાજયોગીપદ પરથી ચૈતન્યની અદામાં નાચ્યા, ઝૂમ્યા, સૌને નચાચ્યા-ઝુમાચ્યા. પોતે સ્વને વિસરી કૃષ્ણમાં લીન થઈ ગયા. કૃષ્ણમય બની ગયા કે પછી સ્વયં કૃષ્ણનો આવિર્ભાવ સાધ્યો. રાજયોગીપદ પરથી કૃષ્ણ સુધી પશ્ચાદ્ગામી પગલાં ભર્યાં ને કૃષ્ણમયતાતું જે વાતાવરણું - જે માહોલ ઉપસ્થિત કર્યો તે તેમની નિનજનંદી મસ્તીના ધોતક હતાં. તેમના નિનજનંદો પ્રલાવ ઉપસ્થિત સૌ પર પથરાયો ને સૌ એ આનંદની મસ્તીમાં મસ્ત બની ગયા. સ્વને વિસરી કૃષ્ણમય બની ગયા. એ વાતાવરણું અલૌકિક હતું. રાજયોગીનો મિનજ અલૌકિક હતો. તેમણે કેસરી રંગનાં વચ્ચો પરિધાન કર્યાં હતાં તે જ તેમની કૃષ્ણમયતાને વ્યક્ત કરતાં હતાં.

ધૂનની રમઝટ વિરામ પામ્યા બાદ હિંચકે બેઠાં બેઠાં જ તેમણે એક રાસની રચના કરી :

આજ આવી આઠમ કેરી રાત, રાધા-કૃષ્ણ રમે રાસ,

શ્રુત્સ કુટિરે રમે રાસ, આજ આવી આઠમ કેરી રાત.

લક્ષ્ણો-રાધા સંગ રમે રાસ, આજ આવી આઠમ કેરી રાત.

રાસની છોળો જિછળો, લક્ષ્ણો આનંદથી ઝૂમે,

આજ આવી આઠમ કેરી રાત....

'શ્રુત્સ' કુટિરે શાંકર આવીયા, શાંકર સાથ કૃષ્ણ રમે રાસ,

આજ આવી આઠમ કેરી રાત....

રાજયોગી રમે રાસ, લક્ષ્ણો ઘેલા થઈ ઝૂમે રાસ,

આજ આવી આઠમ કેરી રાત....

રાસની રમઝટ છેંડીને જંઝટ, લક્ષ્ણોને યાદ રહેશે રાજયોગી રંગત,

આજ આવી આઠમ કેરી રાત....

[આધ્યાત્મિક કેરી, એપ્રિલ, '૬૬]

આ રાસ તેમણે સૌને ગાઈ સંભગાયો. સૌને રાખે રમાડયા.

પોતાના ધરના દેવસ્થાનમાં પદરાવેલી કૃષ્ણની મૂર્તિને અદાર લાની શિર પર ધારીને નાચ્યા, કૃષ્ણા સૌની વચ્ચમાં આવીને! પોતે રાધાભાવ હતા, તો અન્ય ગોપ-ગોપીભાવ. ભાવના આવિભાવ એ જ ઉત્સવ. એ જ જન્માષ્ટમી એમ કહી શકાય.

આખાલખડ - સૌને તેમણે સ્વરૂપે પ્રસાદ આપ્યો.

તેમણે કૃષ્ણભાવને, ગોપીભાવને, રાધાભાવને, એ ભાવના આવિભાવની એક ક્ષાળુને, એક જથુદને તાદ્યા કરી ધનાની. એ ભાવના આવિભાવની ક્ષાળુમાં જ કંઠાંક કૃષ્ણ, કે શંકર, કે રાજયોગી, કે રાધા, કે ગોપી કે ગોપ કે જગતજનનીનાં પાવન પગલાં પડી ચૂક્યાં હતાં. કોઈક હેવી ચરણના પગલાંની છાપ એ સમય ઉત્સવની પદ્ધાદર્શી અનુભૂતિ હતી.



ઘડિયાળના કાંટે

૨૮ જફોટમાં રામા વોય ધન્ડસ્ટ્રીના મંગલ પ્રારંભે પૂ. રાજ્યોગી નરેન્દ્રાંશે પાડવેલા આશિષ - ધ્યેય - સિદ્ધિનો સંદેશ અને પ્રસ્તુત છે. તેમણે જણાયું હતું :

“ રાજ્ફોટ તણી ધરતી પરે, મંગલ પ્રારંભ સાઈટેક્સ ઘડી તણો

આજની ઘડીનાં સંભારણું સાઈટેક્સ ઘડી સાથ

મુજ આશિષ,

સાઈટેક્સ ઘડી સહા ધબકતી રહે સઝળતાનાં શિખરો આપત કરતી રહે.

રામા વોય ધન્ડસ્ટ્રીના પ્રથમ મંગલ સોપાને મારા આપ સર્વને આશીર્વાદ છે. અભિનંદન છે.

કોઈ પણ ધંધામાં ધ્યેયસિદ્ધિ માટે સત્ત્વિક અને સંનિધ પુરુષાર્થ એ પાયાની જરૂરિયાત છે. ધંધાનાં માલિક મા ભગવતી કે આપણું ધિષ્ટદેવને રાખીને આપણે તેના વહીવરકર્તા - કર્મચારી છુંબે તેવી ભાવના કેળવીને આપણે કાર્ય કરીશું તો આપણું અણુંધારી સઝળતા મળતી રહેશે.

કોઈ પણ ધંધામાં નીતિમત્તાનાં મૂહ્યોને હમેશાં પ્રાવાન્ય આપવું. માનસિક શાંતિ અને સંતોષનો સર્વાળો. તમારા ભૌતિક નકામાં અનેક ગણો વધારો કરશો.

વર્તમાન જગત ઘડિયાળના કાંટે ચાલી રહ્યું છે. ઘડિયાળ આપણું સતત પુરુષાર્થ કરવાનું અને નિયમિતતા કેળવણાનું શીખવે છે. નિયમિતતા, પુરુષાર્થ અને શિસ્ત લુંબનમાં અપનાવવામાં આવે તો જ લુંબન સઝળ કરી શકાય, ધ્યેયસિદ્ધ હાંસલ કરી શકાય. મારા આપ સર્વને આશીર્વાદ છે.”

તેમણે માનસિક શાંતિ અને સંતોષ દ્વારા ભૌતિક નકાની જે વાત કરી છે તે ધણી સૂચક, અનુભવ, આદ્ય ને ફંદસ્પતી છે.



આધ્યાત્મિક ફેલી, અપ્રિલ, '૬૬]

તમે કચાં જિલા છો ?

“આજ ભાનુ પ્રકાશિયો, દિન ૬-૧૨-૧૯૬૫ તણ્ણો
ભાનુ પ્રકાશઠો રહે નિશદિન, માત તણી હાજરી હોસે નિશદિન.
આજ શુલ અવસર, આવીયો - સાતમો પાટોસવ
મુજ જન્મદિન તારીખ ૭ મી, માત સાથ બાળ અડો
માત ખૂબ હરખાય,
પકડી મુજ હસ્ત પ્રેમથી, સેનાપતિ આહેશ આપે સૈનિકને,
સૈનિક માર્યાં એન કરતો રહે, કરતો રહે, કરતો રહે.”

રૂપ જ રોજ માતાજીનો પાટોસવ છે. ૬ વર્ષ પૂરાં કરી સાતમા વષનો પ્રવેશ છે.

પરમ તત્ત્વ તો અમર છે. તેનાં વર્ષોનિં ડોઈ હિસાબ હોતો નથી. જ્યારથી અલાંડની રચના થઈ ત્યારથી આખા અલાંડનું સંચાલન કરે છે. તેને વર્ષો, યુગો સ્પર્શતા નથી. પાટોસવ એટલે મારી સમજથી મુજબ માતાજીનો સ્થાપના દિન. જે દિવસે આપણે માતાજીને અતે લાવીને તેમની સ્થાપના કરી, માનપૂર્વક, ભાવપૂર્વક, ધ્યયપૂર્વક અતે રહેવાનું આમંત્રણ આપ્યું તે દિન એટલે પાટોસવ. મનુષ્ય માટે જન્મદિન કહેવાય છે. જ્યારે પરમ તત્ત્વ માટે કે ડોઈ પણ ઈષ્ટદેવ માટે પાટોસવ કહેવાય.

માતાજી અતે બિરાજમાન થયાં ત્યારથી અતે ‘અદ્ધા’માં એવો અહેસાસ થાય છે કે તેઓ અહીં હાજર છે ને તેઓઅનું રહેણાણું કાયમ માટે ‘અદ્ધા’ છે. તેઓઅનીએ આપણુને અધાને ખૂબ ખૂબ અનુભવો કરાવ્યા ને તેમની પ્રસાદીએથી અધાને નવડાની દીધા.

માતાજીએ તો તેમનું કર્તાબ્ય નિભાબ્યું ને આપણે અધાને તેમની હાજરીનો અનુભવ થતો જ રહ્યો. પરંતુ આપણે અધાંએ તેમના માટે શું કર્યું ? તેનો વિચાર કરવો જરૂરી છે. મારે એવું નથી કહેવું કે તેમને કંઈક આપો. પણ તેમની પાસે જવા માટે, તેના રસ્તા શોધવા માટે, રસ્તાની સાફ્સુફી કરવી જરૂરી છે. એટલે કે તમે મન, વચન, કર્મથી કેટલાં પવિત્ર થયાં, અદ્ધા અને શરણાગતિ કેટલી ક્રોણી ? આનો વિચાર કરી આત્મ-નિરીક્ષણું કરશો તો તેમને સમજશો કે તમે કચાં જિલા છો ને તમે માતાજી માટે શું કરી રહ્યાં છો ?

સ્યું તેનો પ્રકાશ પૃથ્વી ઉપર દરેક જગ્યાએ આપે છે તેમ પરમ તત્ત્વ અગર તો માતાજી ખૂબ દ્યાળું છે. તેમની દ્યા સદ્ગ્યા આપણા તરફ વરસતી જ રહે છે. આપણે તો બિક્ષુક જેવા ધીએ ને

તેઓશ્રી તેમના અખૂટ બંડારમાંથી આપણું વહેંચતા જ રહે છે, વહેંચતા જ રહે છે. ને આપણે દુન્યવી માનવીએ ખોજો ભરી ભરીને લઈએ છીએ, છતાં આપણો જોખો ખાલી ને ખાલી જ રહે છે. આપણી માગણીએ વધતી જ રહે છે. પરમ તત્ત્વ કે માતાજી કે તમારા કોઈ પણ ઈષ્ટદેવ તમારી પાસે કોઈ પણ જાતની ભૌતિક માગણી કરતા નથી. પરંતુ તેઓને એઠલી તો મનમાં જીડી જીડી ઈષ્ટા રહે કે મારો ભક્ત સરળ રાહ પર ચાલે, પવિત્ર બનો. જે આઠલું જ તમે કરશો. તો તેમના પ્રીતિપાત્ર અવશ્ય બની શકશો. ને તેઓ તમારી હુરપળે હેખરેખ રાખશો.

ગઈકાલે તા. ૮-૧૨-'૬૫ ને શુક્રવારે રાત્રે નિદ્રાવસ્થા દરમ્યાન માતાજી પદ્ધાર્યાં અને મારા પલંગમાં બેઠા. હું બેઠો થયો. અને માતાજીને વંદન કર્યા. મરક મરક હાસ્ય કેરતાં મને માતાજીએ વહાલથી આલિંગન આપ્યું. વાતસલ્યની વર્ષા કરી. અમે ધર્ણી વાતો કરી. હાસ્યવિનોદ કર્યો. પક્ષી મેં માતાજીને વિનંતી સાથે નભ્ર પ્રાર્થના કરી કે, “આપ મારા થકી ને અનુભવો કરાવો છો તે ન કરાવો. પરોક્ષ રીતે દૂર રહીને અનુભવ થાય તો મને વાંધો નથી.”

માતાજીએ શબ્દો થકી કશું જ અનુમોદન આપ્યું નહિ. પરંતુ જમણો હસ્ત જાંચો કરી મૃદુ હાસ્ય કર્યું. અને માતાજી અંતધર્યાન થઈ ગયાં. હું જંગી ગયો. ધડિયાળમાં રાત્રીના ૧-૪૫ થયા હતા. આ અનુભવ લગભગ ૧૫ મિનિટ ચાહ્યો હતો.”

પૂ. શ્રીનું સમય વક્તવ્ય અને તેમણે માતાજીને કરેલી વિનંતીમાં આત્મભોજનો અનુરોધ છે. ઉપરાંત તેમના અંતરમાં ડેક્કિયું કરવાનો આપણે માટે અવસર પણ નિર્માણ થાય છે. તેમણે માતાજીને કરેલી વિનંતીમાં તેમના અંતરમાં જીડી જીડી રહેલી નારાજગી જ દર્શાવે છે. આ નારાજગી શેની દ્વારા કે શેની છે તે આત્મભોજનો-આત્મનિરીક્ષણનો વિષ્ય છે, અવસર છે. છતાં આપણા પક્ષે એક આરી ઉધાડી રહી ગઈ છે કે માતાજીએ શબ્દો થકી કશું અનુમોદન નથી આપ્યું. આથી આપણે અંતરના ઉત્કટ ભાવથી મા ભગવતીને પ્રાર્થના કરીએ કે, પૂ. શ્રીના સંગે અમને તારી લીલાની-ઉપસ્થિતિની-શક્તિની-પ્રેરણુની અનુભૂતિ કરાવતી રહેને. તને એળખવાનું-પામવાનું સામાન્ય માણુસનું ગજું નથી. તેથી તને તારા અસલ ઇપમાં પામવા એળખવા રાજયોગીનો રંગ અને સંગ બંને જડરી છે તેથી તું તે બંને અમને આપને અને રાજયોગીના સંગમાં ને રંગમાં તારી ઉપસ્થિતિનો અનુભવ કરાવને.

‘શ્રદ્ધા’ના પ્રાંગણુની-‘શ્રદ્ધા’માં ઉજવાતા પાટોત્સવની આ જ એક માત્ર ફ્લાશ્ચુટિ હોઈ શકે-નિષ્પત્તિ હોઈ શકે.



જ્ઞાનગોપિ

૪૦ ગુરુહેવ, આપે કહ્યું છે ને “પાપત ક્રાંતિ રાખજે હૃદયમાં, અન્યથા કમળ તણી પાંખડીઓ ખરી જશે.”—એ દ્વારા આપ શેનો નિર્દેશ કરવા માગો છો ?

૭૦ કમળ કરમાય એઠલે એની પાંખડી ખરી જય છે. કમળ જેવો સ્વર્ચ, પવિત્ર અને નિર્દેશ આત્મા ધારણું કરીને આવેલો મનુષ્ય અંતે પંચમહાભૂતમાં ભળી જવાનો છે તેથી ગુરુ જે શીખ આપે છે તેને હૃદયમાં રાખવાની છે, જીવનમાં ઉતારવાની છે. એ નહિ ઉતારશો તો આ જીવનનો અસ્ત તો થવાનો જ છે ને જીવું સાર્થક કરવાને બદલે વ્યર્થ વેડિશાઈ જશે એઠલું જ નહિ, કર્માંના બંધનો સાથે લઈને જઈશુંને સાથે લઈને આવીશું. ઉપરાંત જન્મમરણનું ચક્ક પણ ચાલુ જ રહેશે. માટે જન્મ-મરણનાં ચક્કમાંથી સુક્તા થવા અથવા સારું ચુખ્ખી સમૃદ્ધ જીવન પ્રાપ્ત કરવા ગુરુની શિખામણુને હૃદયમાં-જીવનમાં જિતારી પરમ તત્ત્વની સમૃતિને સતેજ રાખવાથી આત્મ-કલ્યાણ સાધી શકશે.

૪૦ ‘સંસાર સાગરે જ્ઞાન અને સમજ, જાંજવાં તણું નીર સમાન’ એમ કહ્યું છે તે કેવી રીતે ?

૭૦ જાંજવાનાં નીર એ એક આભાસ માત્ર છે. એ સાચા અર્થમાં નીર નથી હોતું. એ જ રીતે મનુષ્ય સંસારમાં રહીને ગુરુ પાસેથી કે અન્ય રીતે અનેક પ્રકારની સમજણું પ્રાપ્ત કરે કે જ્ઞાન મેળવે પણ યથાસમયે તેનો ઉપયોગ ન કરે, તેને જીવનમાં ઉતારે નહિ તો તેનો કંઈ અર્થ નથી. જાંજવાનાં નીરની જેમ જ્ઞાન અને સમજ જીવનમાં એક આભાસ માત્ર જ બની રહે છે.

“જીવ પરમ તત્ત્વની શરણુંગતિ સ્વીકાર્ય પઢી પણ નિર્દેશપતા અને અનાસંક્ષિત કેળવે તો જ આધ્યાત્મિક ગતિ કરી શકે, પરમ તત્ત્વની અનુભૂતિ મેળવી શકે, અન્યથા નહિ.”

સંસારમાં પ્રાપ્ત કરેલા જ્ઞાન અને સમજનો જે મનુષ્ય યથાગોચ્ચ સમયે, અને સ્થળે વિનિયોગ કરી જશે છે, તેને સંપૂર્ણપણે જીવનમાં જિતારે છે ને તે પ્રમાણે આચરણ કરે છે તે જીવનસાગર પાર કરી શકે છે.

મેં આપને મન, વચ્ચન અને કર્મની પવિત્રતા વિશે સમજબયું અને હું માની લઉં છું કે એનો મર્મ તમે સૌ પાંચી શકશો. મને તમારા સૌમાં વિશ્વાસ છે. તમે ધણું સમજુ છો. અને ધણી સમજ-જ્ઞાન તમે પ્રાપ્ત કર્યાં છો. વળી હું જોઈ શકું છું કે માતાજીની તમારા સૌ પર ખૂબ સરસ કૃપા અને પ્રેરણું જિતરી છે. એ કૃપા અને પ્રેરણુને દીપાવલા માટે મન, વચ્ચન ને કર્મની પવિત્રતા અનિવાર્ય છે, આવશ્યક છે. એઠલું જ નહિ, સમયની તાકીદ છે, તાતી માંગ છે. પરમ તત્ત્વની પ્રાપ્તિ

માટે, તેની વધુ ને વધુ સમીપ જવા માટે મન, વચન ને કર્મની પવિત્રતા જરૂરી છે. ને તેથી તે દિશામાં તેનું આયરણ કરો, તેને સળજડ રીતે, એક શિસ્તઅષ્ટ સેનિકની અદાથી, કર્મવીર બનીને જીવનમાં જાતારો એવી હું તમારી સૌની પાસેથી અપેક્ષા રાખ્યું હું. આશા છે મારા વહાલા બન્ધુ તરીકે મારી આટલી અપેક્ષાને પરિપૂર્ણ કરશો અથવા પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરશો.

૪૦ પરમ તત્ત્વની પ્રાપ્તિમાં મન, વચન અને કર્મની પવિત્રતાં કઈ રીતે ઉપકારક બને છે તે સમજાવશો ?

૭૦ સૌ પ્રથમ તો પરમ તત્ત્વની પ્રાપ્તિ એટલે શું તે તમે સમજ દો. પરમ તત્ત્વની પ્રાપ્તિ એટલે ભગવાન સાક્ષાત સદેહે ઇપ ધારણું કરીને તમારી સામે આવી જોબા રહે. તો જ પરમ તત્ત્વની પ્રાપ્તિ થયેલી ગણી શકાય એવું નથી. દરેકને માટે એ શક્ય નથી. કોઈને માટે એ શક્ય નથી. જે પરમ તત્ત્વનો અંશ હોય તેને માટે જ તે સાકારિપ ધારણું કરે છે એ મેં તમને જણાયું છે.

આ હકીકતને બાદ કરતાં પરમ તત્ત્વની પ્રાપ્તિ અનેક રીતે થાય છે. મનુષ્યનાં અનેકવિધ કાર્યો સરળતાથી પાર પડે છે. જીવનમાં ધર્ષણી એવી બાધતો અનતી હોય છે, જેમાં ન ધારેલી સંકળતા મળે છે, ન ધારેલી સહાય આવી મળે છે. અનેકવિધ રીતે સાતુર્ણુણતા મળતી રહે છે. સંતોના આશીર્વાદ, કૃપા અને સાનિધ્ય મળે છે. જીવનમાં સાચા સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. આવી અનેકાનેક બાધતો પરમ તત્ત્વની પ્રાપ્તિ જ ગણ્યાય છે. પરમાત્માની એ પરોક્ષ અનુભૂતિઓ છે એવી પરોક્ષ અનુભૂતિઓ પણ તેની પ્રાપ્તિ તરીકે ગણી શકાય.

પરંતુ આવી પરોક્ષ-અપરોક્ષ અનુભૂતિઓ પ્રાપ્ત કરવાં મન, વચન ને કર્મની પવિત્રતા જરૂરી છે.

મન પવિત્ર કચારે બને ? નિયમિત ઉપાસના અને સત્સંગથી મન સ્વસ્થ, શાંત અને પવિત્ર બને છે. પરમ તત્ત્વમાં અદ્વા જરૂરી છે. મન શાંત અને સ્વસ્થ બને એટલે વિચારો પવિત્ર બને છે. ઉદાર, ઉદાત વિચારો ઉદાભી શકે છે. વિચારો ઉદાર બનવાથી વૃત્તિ અને પ્રવૃત્તિ પવિત્ર અને સન્માર્ગગામી બને છે. સંસારનાં કાર્યોમાં અને પરમાત્મા સાચે ભાવાત્મક એકરસતા સાચી શકાય છે અથવા તો સાધવાની પ્રેરણા મળે છે. પરમાત્મા સાચે ભાવાત્મક એકરસતા સધાતાં સન્માર્ગ કદ્યાણુકારી પ્રવૃત્તિ થઈ શકે છે.

“ મારા વહાલા બન્ધુ તરીકે મારી આટલી અપેક્ષાને પરિપૂર્ણ કરશો અથવા પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરશો એવી આશા છે.”

પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે, તેની અનુભૂતિ માટે ભાવાત્મક એકરસતા જરૂરી છે. અનિવાર્ય છે.

આપણે પરમ તત્ત્વની અદ્વાપૂર્વક ઉપાસના તો કરીએ પણ પણી ધરમાં કે અધાર ગમે ત્યા ગમે તેની સાચે ઉધ્ઘતાઈપૂર્વક, કડોરાતાથી વર્તીએ, તેનું દિલ પૂરી જય, તે હતાશ થઈ જય, ભાંગી પડે તેવી વાણી ઉચ્ચારીએ, અથવા તો કોઈ પણ વ્યક્તિના કાર્યમાં ઉખલગતીરી કરવાનો વિચાર સરખો પણ આવે તે ઉચ્ચિત નથી. કોઈના માર્ગમાં આપણે આપણી હીન વૃત્તિ-પ્રવૃત્તિઓથી અન્તરાય ઇપ બનીને, તેના જીવન અને કાર્યમાં કિલાફ્ટતા જોલી કરીએ, તેને તેના લાભોથી વંચિત રાખીએ તેવા વિચાર,

આદ્યાત્મિક કેવી, એપ્રિલ, '૬૬]

વાળી અને વર્ત્તન મનુષ્યને અપવિત્ર બનાવે છે. ને તે તેને માટે અનુભનકર્તાની નીવડે છે. એટલું જ નહિ, પરમાત્માની કૃપા, આશીર્વાદ, પ્રેરણા ને પ્રેમ પ્રાપ્ત કરાવી આપવામાં અવરોધ રૂપ અને છે. એથી યે વિશેષ જે પરમ તત્ત્વની કૃપા, આશીર્વાદ સંપાદન કર્યાં હોય તો તેમાં એટ આવે છે. પરમાત્મા નારાજ અની તેવા મનુષ્યથી વિમુખ અની જય છે અને પછી તેવો મનુષ્ય સમય જતાં અધ્યપતનની ગર્તામાં ધકેલાય છે.

આથી હવે તમે જ નક્કી કરી લો કે તમારે અધ્યપતનની ગર્તામાં ધકેલાવું છે કે ઉન્નતિના માર્ગ આગળ વધવું છે.

જે તમારે ઉન્નતિના માર્ગ આગળ વધવું હોય તો સૌ સાથે પ્રેમ અને આત્મીયતા ડેળવો. સૌને ઉમળકાલેર આવકાર આપો. દરેકની મુશ્કેલીને, પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. સૌને માટે સહાતુભૂતિ રાપો. તમારા હૃદયમાં સ્નેહનાં સ્પંદનોને અણુઅણુતાં રાપો - સહાયને માટે, મન, વચન ને કર્મની પવિત્રતાને ખૂબ જ સરળતાથી સહેલાઈથી આત્મસાતું કરી, શક્શો. હું તમને ખાતરી આપું છું, તમારું લૌટિક જીવન પણ સુખી બનશો એટલું જ નહિ, આધ્યાત્મિક માર્ગ પણ તમારી ગતિ ઝડપી અની જશો.

૫૦ આપે જણ્ણાંયું છે કે મૃત્યુ પછી આત્મા આર જ કલાકમાં ફરી જન્મ ધારણ કરે છે તો એનો સીધો અર્થ એવો થાય છે કે મરણોત્તર ડ્રિયાનો પછી કંઈ અર્થ જ નથી રહેતો. મરણોત્તર ડ્રિયાએ વિશે આપનો શો અભિગ્રાય છે તે વિશે પ્રકાશ પાડશો?

“જે તમારે ઉન્નતિના માર્ગ આગળ વધવું હોય તો સૌ સાથે પ્રેમ અને આત્મીયતા ડેળવો. સૌને ઉમળકાલેર આવકાર આપો. દરેકની સુરક્ષેત્રને, પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. સૌને માટે સહાતુભૂતિ રાપો. તમારા હૃદયમાં સ્નેહનાં સ્પંદનોને અણુઅણુતાં રાપો - સહાયને માટે, મન, વચન ને કર્મની પવિત્રતાને ખૂબ જ સરળતાથી-સહેલાઈથી આત્મસાતું કરી શક્શો. હું તમને ખાતરી આપું છું, તમારું લૌટિક જીવન પણ સુખી બનશો એટલું જ નહિ. આધ્યાત્મિક માર્ગ પણ તમારી ગતિ ઝડપી અની જશો.”

૭૦ આ લોક કે પરલોકમાં પણ આત્મા તો અમર છે. તે ઐળિયું ઘણલે છે. અન્ય શરીર ધારણું કરે છે આથી મરણોત્તર ડ્રિયાએ અને જમણવાર એ કેવળ લોકાચાર છે. વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવતી કોઈ પણ ડ્રિયા કે દાન-દક્ષિણા તેને પહોંચી શકે નહિ અને પહોંચતાં નથી. તેથી તે જરૂરી નથી એમ હું માતું છું. વ્યક્તિ જે કંઈ કાર્ય - સારું કે માહું - દાન, ધર્મ, પુણ્ય કરે છે તે તે જ તે સાથે લઈને જય છે અને તેનું સંચિત કર્મ રૂપે અન્ય જીવનમાં ઉપકારક કે અનુપકારક બને છે. વ્યક્તિ જીવતેજીવત જે કંઈ કરે છે તે જ તેની સાથે આવે છે, જેથી જે કંઈ દાન - પુણ્ય કરવાની દીચ્છા છે તે જીવતેજીવત જ કરવા જરૂરી છે!

એમ કહેવાય છે કે જીવ આર દિવસ સુખી બારણુને ટોડલે એસી રહે છે. અને તેને પિંડાન દીધા પછી જ તેની સહગતિ થાય છે. આ બાયત સત્યથી વેગળો છે. કારણું બાર કલાકમાં જ આત્મા જન્મ ધારણ કરતો હોવાતું સ્વયં માતાજીએ જણ્ણાંયું છે.

મરણ પછી ને સૂતક-આભડ્યેટ પાળવામાં આવે છે તે જરૂરી નથી. ધરમાં મરણ થયા બાદ કોઈ ધરકામ ન કરવા પાછળ કે પૂજાપાઠ ન કરવા પાછળ કેવળ સ્વજનના મૃત્યુનો આધાત રહેલો છે. એ આધાતમાંથી ખંડાર લાવવા સ્વજનો સ્નેહીએ મિત્રો એસવા આવે છે, મળવા આવે છે, વ્યક્તિ પૂર્વવત પોતાનાં કાર્યોમાં જેતરાઈ જય તે માટે સૌ લેગાં મળી જમવાનું આપોજન કરવામાં આવે છે. આમ જમણુવાર એ પણ લોકાચાર છે.

વ્યક્તિના મરણ બાદ પૂજાપાઠ પણ થઈ શકે છે. કોઈ પણ પ્રકારનો શોક પાળવાનું જરૂરી નથી. માતા-પિતા કે અન્ય વડીલના મૃત્યુ બાદ પુત્રે કે કુદુર્યના અન્ય પુરુષ વર્ગે માથું એડાવવાની કે દાઢી ન કરવાની જરૂર નથી.

“મરણોત્તર કિયા કેવળ લોકાચાર છે. વ્યક્તિના મૃત્યુ પછી તેને માટે કરવામાં આવતી કોઈ કિયા તેને પહોંચતી નથી તેથી તે જરૂરી નથી.”

મારા પિતાના અવસાન બાદ હું મારી પૂજા નિયમિત પૂર્વવત કરતો હતો. મેં માથું પણ એડાવ્યું નહોતું તેમ જ નિયમિત દાઢી પણ કરતો હતો. મેં માતાજીને આ વાત રજૂ કરી હતી અને તેમણે જણાવ્યું હેતું કે પૂજાપાઠ કરવામાં કોઈ વાંઘે નથી. વાળ ઉત્તરાવવા વગેરે બાધત લૌકિક છે. એને ધર્મ સાથે કોઈ નિસયત નથી. આ કેવળ લોકાચાર છે.

વળી અત્યારે આપણે જોઈશું કે ધર્મી જ્ઞાતિઓમાં આવા રીતરિવાજેને તિલાંજલિ આપવાના દૂરાવો કરવામાં આવે છે, તે ધર્મી સારી બાધત છે.

પ્ર૦ બાર કલાકમાં પુનર્જન્મ કરી રીતે તે જમનજવશો ?

ઉ૦ માતાના ઉદ્દરમાં ગર્ભ ધારણ કર્યા બાદ નવ માસ સુધી તો માતાના ઝોરાક, શાસોચ્છવાસ વગેરેથી... પોષણ પામે છે અને ગર્ભનો વિકાસ થાય છે. પણ નવ માસ પૂરા થયા બાદ ગર્ભમાંથી ખંડાર નીકળતાં પ્રથમ શાસો જ તેનામાં આત્માનો પ્રવેશ થાય છે. આમ માતાના ઉદ્દરમાંથી ખંડાર આવવાની ધર્તના તે મૃત આત્માનો પુનર્જન્મ છે. બાર કલાક પૂરા થવાની છેલ્લી ક્ષણોમાં માતાના ઉદ્દરમાંથી ખંડાર આવતાં આત્મા જીવમાં પ્રવેશ છે ને તે પુનર્જન્મ ગણ્યાય છે.



શાંતિ

તા. ૯-૧૨-'૯૫ના રોજ 'અદ્ભુત' ફુરીમાં થયેલ 'જ્ઞાનગોળિ'ના સંકલિત અંશો

કૌશલ : શાંતિથી આપણું જીવન સુખમય અને આનંદમય અને છે. શાંતિ વિના જીવન પૂર્ણ નથી. શાંતિથી કાર્યમાં એકાયતા મળે છે. શાંતિ હોય ત્યાં યુદ્ધ નથી. પુસ્તકાલયમાં શાંતિને લીધે વાંચનમાં એકાયતા, મહિરમાં શાંતિને લીધે પ્રાર્થનામાં એકાયતા અને ફૂરીમાં શાંતિને લીધે માતાજીની પ્રસાદી મળે છે.

ભાવિન : મનની શાંતિ એ મુખ્યવાન છે. ન્યાં સુધી માણુસ પોતાની જલને નહીં સમજે ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત નહીં થાય. ન્યારે માણુસને સાચા કાર્યોનું મહત્વ સમજશે ત્યારે અજાપો દૂર થશે અને શાંતિનો અતુલવ થશે. ગુસ્સો અને અધીરતા જય ત્યારે જ શાંતિ આવે.

રાજેધીરી : શાંતિ કચારેય ઇપિયાથી નથી ભળતી. જેનું મન કોધીલું હોય તેને શાંતિ નથી ભળતી. ફૂરીમાં ગુરુહેવ અને માતાજીની વચ્ચે બેસીને મને શાંતિ મળે છે.

હેમંતભાઈ : પરમ તત્વ કોઈને પણ શાંતિ જવલ્લેજ આપે છે. આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં કોઈ પણ અપેક્ષા વગર, અશાંતિ સર્જનારા હુઃખ દ્વારા સ્વીકારી મનુષ્યને શાંતિ અર્પનારી આપણા રાજ્યોગી પૂનય ગુરુહેવ જેવા સંત થયા નથી અને થશે પણ નહિં. સદ્ગુરૂદ્વિદ્યા જ મનની એકાયતા કેળવાય જેનાથી શાંતિ મળે. માનવતા વ્રત અને પૂનયશીના આશીર્વાદ અને કૃપાથી સ્વર્ગ, અંતરીક્ષ, પૃથ્વી, જળ, વનસ્પતિ, ઔષધી, આધિ, વ્યાધિ, ઉપાધમાંથી આપણું શાંતિ મળે એ જ પ્રાર્થના.

રમેશભાઈ : શાંતિ જોઈતી હોય તો વ્યવહારમાં મનને ન ફૂસાવશો. સતર્ક રહો. વાસનાના વમળમાં નૌકા ડૂધી ન જય. ફૈલીગુણો વધારો, કોઈની નિંદા ન કરો, વિષયોમાં સુખ નથી, અનિષ્ટ ચિંતન ન કરશો.

જસ્વંતભાઈ : માનવીને જે મળ્યું છે એમાં આત્મસંતોષ નથી અને તે મેળવવામાં જ શાંતિ હણ્યાઈ જય છે. રોડ પરના વાહનવ્યવહારનો ધર્મ છે કે અથડાશો તો મરી જશો, અથડાવામાં જોખમ છે. આપણે માનવ-માનવ વચ્ચે અથડાઈને અશાંતિ ઊભી ન કરીએ. શાંતિ પ્રાપ્ત કરવાના ડાન નિયમો બતાવીને, માનવતા વ્રત દ્વારા માનવ-માનવ વચ્ચે પ્રેમભર્યા વાતાવરણ સર્જવાની હિમાયત કરી.

સુકુમાર : શાંતિ એ પ્રકારની: ખાદ્ય અને આંતરિક. બહારના વાતાવરણની આપણા મન પર જરૂર અસર થાય છે પરંતુ બહારનું વાતાવરણ શાંત હોય તો આંતરિક શાંતિ જગવાઈ રહે તેવું નથી. આંતરિક શાંતિ આપણે જાતે નિર્માણ કરવાની છે. આપણું ભયગ્રસ્ત ચિત્ત આપણામાં અશાંતિ

[આધ્યાત્મિક કેદી, અપ્રિલ, ૧૯૬૫]

સર્વે છે. ભ્યનાં કાલ્પનિક વિચારો જરૂરીતિનું અશાંતિનું છે. જેટલા વિચારો વધારે તેટલી શાંતિ ઓછી. જીવનમાં કચારેય સંપૂર્ણ શાંતિ હોતી નથી. સંપૂર્ણ શાંતિ એટલે વિચાર શુદ્ધતા અથવા મૃત્યુ. આવી પરમ શાંતિ આપણે નથી જોઈતી. હંમેશા આપણે પ્રભુની રચનાત્મક પ્રાર્થના કરતા રહીએ જેથી વિચાર શુદ્ધતા નહીં પણ રચનાત્મક વિચારો સ્કૂરે જે મન પુલકિત કરે.

મનિષભાઈ : આત્માને શાંતિ મળે તેવા તપનું આચરણ એટલે શાંતિ. શાંતિનો અનુભવ આત્માથી થાય. આત્મા-પરમાત્માનું મિલન એટલે શાંતિની આબત્તા. ગુરુદેવની આજાનું પાલન, ધર્મનું આચરણ, સત્કાર્ય અને સહસેવાથી અલૌકિક શાંતિ મળે. આત્મસતેષ થાય તેવા કાર્યો કરવાથી હૃદયમાં ઉદ્ભવતો રોમાંચ એટલે શાંતિ. સતેષ એ શાંતિનો અનુગામી છે. સતેષ હશે તો જ શાંતિ મળશે. મનને જેટલું કેળવો તેટલી શાંતિ મળે. પ્રતિકૂળ સંનેહો ઈશ્વર નિર્ભિત ઈચ્છાથી જ થયા છે એનો અદ્ભુ અને શરણાગતિથી સ્વીકાર કરે.

ભારતભાઈ : પાટોસવ પ્રસંગે યોગનુયોગ શાંતિ-પ્રસાદ સહુને મળી રહ્યો છે. શાંતિના કેટલાય સ્વરૂપ : નિરવ શાંતિ, માનસિક શાંતિ, શારીરિક શાંતિ, ગૃહશાંતિ, આત્મશાંતિ, શાખત શાંતિ, હિંદ્ય શાંતિ અને પરમ શાંતિ... અદ્ભુ અને શરણાગતિ આપણને શાંતિના સામ્રાજ્યમાં પ્રવેશ આપે છે. અમોને સર્વ દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત થાલ એ જ શાંતિ પ્રાર્થના છે. પૂજ્ય ગુરુદેવની આજાનું પાલન એ જ પરમ શાંતિ છે. શાંતિનો વ્યાપ વધતો જય, સાંસારિક વિષિતિએ દૂર થતી જય અને પૂજ્યશ્રીના ચરણોમાં પરમ શાંતિ પામી શકીએ એ જ પ્રાર્થના.

ધર્મન્દ્રભાઈ : નદીઓ સાગરમેં અહેતી હે, સાગર જાતા હૈ મહાસાગરમેં... લેકીન યહાં મા ગાયત્રી કી ગંગા ઉલ્લી બહૃતી હૈ... મહાસાગર સે ગુરુદેવ ઇપી સાગરમેં આકર હુમ નદીયોંમેં બહૃતી હૈ. ઉલ્લા સામ્રાજ્ય... હિન મેં કરોગે યાદ... હિન = નદી બહૃતી રહેણી - રાતમેં કરોગે યાદ - રાત તર જાઓગે... ઔર કબી ભી યાદ કરોગે... યાદ = દ્યા મિલતી રહેણી... પૂજ્યશ્રી રાજ રામયંદ્રા ઔર કૃષ્ણશ્રી કી બાતે કરતે હૈન, કૃષ્ણ યોગી હૈ... ગુરુદેવ રામયંદ્રા તરહ રાજ ઔર કૃષ્ણ કી તરહ યોગી હૈ ધસલિયે રાજ્યોગી હૈ ઔર નરનારાયણ ધન્દેવ હૈ ધસલિયે નરેન્દ્ર હૈ. આપ પૂર્ણ હૈ.

ભાવનાથભેન : ભગવાને કેવો સરસ શખદ આપ્યો છે : શાંતિ...પણ આપણને તેનો ઉપયોગ નથી આવડયો. શાં = શરણુમાં, તિ = તૃપ્તિ. ભગવાનના શરણુમાં જરૂર તૃપ્તિ મળે તેવું...શાંતિ. શાંતિ માનસિક હોવી જોઈએ. જીવનની શરણાત શાંતિથી જ થાય છે પણ આપણે અશાંતિ માનીએ છીએ. એક સાધુની વાર્તા દ્વારા કંદું કે સૌથી પહેલું કામ તો અંતરના પાત્રને સાઝ કરવાનું છે. એમાં જ્યાં સુધી લોબ, મોહ, ધૂળા, કામ-કોધ ભર્યા હશે ત્યાં સુધી શાંતિ નહીં મળે. અંતરું દર્પણું સાઝ કરીએ તો જ પરમાત્માનું પ્રતિબિંબ આપણને શાંતિમાં દેખાશે. આપણે રાજ્યોગીજીની કૃપાથી જુંદ્યોને સરળ માર્ગ શાંતિથી અપનાવીએ.

રીટાથભેન : શાંતિ એ આત્માનો નિઃ ગુણ છે. આત્મા ખુદ પોતે જ શાંતિના સાગરપિતાની સંતાન શાંત સ્વરૂપ છે. આપણે નિઃ ગુણ શોધ્યા વગર અહીં તહીં ઇંદ્ર મારીએ છીએ, જે કળિયુગી દુનિયામાં શાંતિ આપણને કચાંય નહીં મળે. શાંતિ પ્રાપ્ત કરવા આપણે પરમાત્માની યાદમાં તપસું પડે. જેથી કામ, કોધ, લોબ, મોહ જેવા વિકારો તેના તાપથી તપસીને દૂર થાય.

આધ્યાત્મિક કેટી, એપ્રિલ, '૯૬]

સ્વનેહાખ્યાન : શાંતિ એટલે આપણા મનની માનસિક સમતુલ્યા. આજે માનસિક તથાવનો રોગ સામાન્ય થઈ ગયો છે. ને અશાંતિ સૂચને છે. તમે તમારા ચિંતને આદેશ આપો : Don't be upset, calm down - તો તમારી વ્યાકુળતા ઓછી થઈ જશે અને સ્વસ્થ ચિંતા રહેવા શક્તિમાન બનશો. અને તો આવેશમાં વેડિશાતી શક્તિએ, શરીરમાં ઉદ્ભબવતી વ્યાધિએ જેવી કે હાયપર ટેન્શન, બી. પી. વરોરેભાંથી છૂટકારો મેળવશો. મનના ઉદ્ભવેનું વખતે ચોણ્ય માર્ગ કાઢવાનો વિચાર માત્ર પ્રસન્નતાથી જ આવે. અશાંત થઈ જવાથી વાસ્તવિક પરિસ્થિતિમાં કાંઈ દૂર પડતો નથી. જીવનને ઉલ્લભાસ અને પ્રસન્નતાથી ભરી દો.

સતીષભાઈ : છટાલીના સરમુખત્વાર મુસોલિનીએ ખીલ વિશ્વયુદ્ધ વખતે રાજ્યાંગે સૂત્ર આપેલું કે "War is to man, what maternity is to woman. If you want peace, you must have a war." એક વેપારીની શાંતિ, રોજ સાંજે ધારેલી સિલક મેળવી લેવામાં, સંસારીની શાંતિ પુત્રેષણા, ધરેષણા અને વિતેષણામાં પર્યાપ્ત થાય છે. પ્રત્યેક ક્ષેત્રે ભલે પરિધિ બદ્લાયા કરે છે પરંતુ કેન્દ્ર તો સિથર જ રહે છે. ચોગીએ અને ગીતા, અન્નેના મત અનુસાર, ઈન્ધા-એષણાનું ક્ષીણું થતું એટલે શાંતિ. જેઠલા પ્રમાણુમાં કામનાએ ધર્તી રહે તેથલા પ્રમાણુમાં શાંતચિત્ત પ્રકૃતિ આવતી જય છે. એક અમણી મજૂર કે લિખારી શાંતિનો અનુભવ કરતો હોય છે ત્યારે આરામદાયક મારુતિમાં એસનાર અજંપાની હેંડેગ સાથે લઈને જ એડો હોય છે. જીવનનો આ વિરોધાભાસ છે. શાંતિમાં અશાંતિ કે અશાંતિમાં શાંતિ. વિશાન સ્થળ શાંતિ, પદ્ધતિ શાંતિ અર્પણ રોજરોજ પ્રતિઅદ્ધ રહ્યું છે. પણ તે માનવ મન, માનવ અંતર કણી શક્યું નથી તે આશ્ર્ય છે. જગતના નાના મોટાં સધળાં ધર્માંએ શાંતિની હિમાયત કરી છે, શાંતિપાડો રચેલાં છે, હિન્દુ ધર્મપ્રવાહે તો હરેક સૂત્ર પર શાંતિ ક્વય પહેરાવ્યું છે. છતાંય શાંતિની શોધ, શાંતિ માટેની વિધિ, શાંતિ વડે સાધનાની એવના હજુ ચાલુ જ રહી છે અને રહેશે. શાંતિના સાચા અર્થ અને અનુભવ દૂર દૂર જતા જય છે, અને માનવી શાંતિના પડ્છાયાથી આનંદ લીધા કરે છે. રાજ્યોગીની 'જીવનશાંતિ'ની સમજૂતિ ધર્ણી અર્થ સભર છે, મહત્વપૂર્ણ છે. જ્યારે પણ એવના થાય, મહત્વકાંક્ષા ઉદ્ભવે, મેળવવાની ભાવના જાગૃત થાય, કર્મ કરવાની આકાંક્ષા થાય ત્યારે તેની ક્રિયા પહેલાં જ તેની સાથે 'પરમ શક્તિ મંત્ર' જોડી ધો. પછી ભલે કર્મ કરો. શાંતિ અને સુખ માટેના પરિશ્રમનું ઇળ સુયોગ હશે. જુંદ્ગીનો આખરી ઉત્સવ મૃત્યુ તો તમને શાંતિમાં ભેળવી દેવાનો જ છે પરંતુ તે પહેલાં પણ જીવતરમાં તમે શાંતિને પ્રાપ્ત થઈ જય... રાજ્યોગીનું ચિંતન કરું છે કે તમે શાંતિને પ્રાપ્ત થાવ, સમર્પિત થાવ, ભાવભીતરી થાવ. એક શર્ષદમાં શરણ્યાગતિને અંતર્ગત થાવ.

૫. બહેનાં :

* ને ભીતરમાં ભાસે શાંતિ, તો સમાનિતમાં વરતાયે શાંતિ....

* આત્મશક્તિનો છે જ્યાં આવાસ,

આત્મશાંતિનો છે જ્યાં વાસ....

શાંતિ-શક્તિનું ને થાયે મિલન

શિવ-શક્તિનું પામી શકાય અવલભન....

[આધ્યાત્મિક કેડી, એપ્રિલ, ૧૯૬૬

* ન મળે શાંતિ, લક્ષ્મીની રૈતમછેતમાં
 ન મળે શાંતિ હિમાલય તણું શિખરે
 ન મળે શાંતિ, ગિરી કંદરાઓમાં
 ન મળે શાંતિ, એકાંતવાસમાં....

મળે શાંતિ, જે હોય પવિત્રતા મન-વચન-કર્મ તણી
 મળે શાંતિ જે હોય ઐકયતા વાણી, વર્તન વ્યવહાર તણી....

મળે શાંતિ જે હોય સંતોષ જીવનમાં
 મળે શાંતિ જે હોય ગેરહાજરી પરિપુઞ્ચો તણી....

મળે શાંતિ જે હોય પરમનું સાનિધ્ય સર્વેદા....

* શાંતિ સ્થાપવા સ્વયમ્ભુ શાન્ત થાવું પડે....
 શાંતિ આપવા સ્વયમ્ભુ શાન સુધારવી પડે....
 શાંતિ પામવા સ્વયમ્ભુ સમજ કેળવવી પડે....
 શાંતિ પ્રસરાવવા સ્વયમ્ભુ શહીદ થવું પડે....
 ત્યાગ અને સેવાનો લેખ ધારણું કરવો પડે....

શૂન્ય ગુરુહેવ :

આંતર બાદ્ય કરો એક સમતોલ રાખો પરમને અને સંસારને....
 તન, મન આનંદિત થાશે અનુભવશો શાંતિ, શાંતિ....

શાંતિ માટે તમારે બહાર જવાનું નથી અથવા તો શાંતિ બહાર વેચાતી મળતી નથી. શાંતિ માટે તમારે અંદર અને બહાર એક જ જાતનો વાણી, વર્તન અને વ્યવહાર કરવાનો, પરમ તત્વને અને સંસારને સમતોલ રાખો. સંસારમાં રહી કર્યું કરો પરંતુ ધ્યાન પરમ તત્વમાં આપશો. તમને તન અને મનની શાંતિ મળશે. મનની શાંતિ એટલે અંદરથી આવતો આનંદ. તનની શાંતિ એટલે જેમકે ઉનાળામાં એક દંડી લાલ આવતે, આપણું તનને સ્પર્શિને તમને આનંદ આપ્યે જે તેવી શાંતિનો કાયમ માટેનો અનુભવ, શાંતિ મેળવવા ને રાખવા માટે આપણે પોતે જ પ્રયત્ન કરવો જોઈએ ને તે મુજબ જ પોતાનો સ્વભાવ ઘડવો જોઈએ. ક્ષણિક શાંતિ થાય, પરંતુ તે શાશ્વત રહે તેવો પ્રયત્ન કરવો જરૂરી છે.

શાંતિનો અર્થ મારી દસ્તિએ :

શ = શક્રા એટલે ખાંડ, ન = નમજું - નમન કરવું, ત = તરી જરૂરું.
 ખાંડ જેવા મીઠા મધ્ય અનીતે નમતા રહેલો તો સંસાર સાગર તરી જાશો.

॥ ઊં મા ઊં ॥



શાંતિ - પ્રક્રોતારી

તા. ૧૦-૧૨-'૬૫ ના રોજ 'શ્રીજી' કુટિરમાં થયેલ પ્રક્રોતારી

[પૂજય ગુરુહેવના જવાઓ તેમના શાસ્ત્ર અને મંત્ર્ય પર આધારિત]

૧. પ્ર૦ : આપે શાંતિના વક્તાવ્યમાં કર્યું કે પરમ તત્ત્વ અને સંસારને સમતોલનમાં રાખો તો આ કેવી રીતે કર્યું ?

જ૦ : રીતે સંસારમાં રચ્યાપચ્યા રહેણ છો તેવી રીતે પરમ તત્ત્વ માટે પણ રચ્યાપચ્યા રહેણ. પરમ તત્ત્વના પદ્ધતામાં ભક્તિરૂપી વજન મૂકો અને સંસારમાં વ્યવહારરૂપી - બન્ને વચ્ચે સમતોલન કરો.

૨. પ્ર૦ : સંસારમાં અને ભક્તિમાં સરાઓ સમય આપવો ?

જ૦ : એવું મારું કહેવાતું નથી પણ ૨૪ કલાકમાંથી પ્રલુ માટે સમય તો દ્રાગવો જ જોઈએ. માત્ર હુઃખ પડે ત્યારે જ સમય મળે એ બરાબર નથી.

૩. પ્ર૦ : પ્રલુની ઉપાસના માટે સમય અને સ્થળ એક જ હોવાં જોઈએ ?

જ૦ : ઉપાસના માટે ગમે તે સમય અને સ્થળ ચાલે પણ અતુષ્ણાત કરતાં હો તો સમય અને સ્થળ સાચવો.

૪. પ્ર૦ : મનુષ્યની માનસિક સ્થિતિ બરાબ થાય ત્યારે એમાંથી જલ્દી બહાર નીકળી જવું જોઈએ. અમેરીકન સાઈકોએગ્રીક એસોસીએશનના એક મેન્યુઅલમાં સર્વે પરથી જણ્ણાવે છે કે આ માટે ઓછામાં ઓછા એ અદ્વારીયા સમય લાગે-ત્યાં ચુંધી શારીરિક અસર પણ થઈ જય-ભૂખ વધે વજન ઘટે વગેરે...તો આ પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળવા શું કર્યું ?

જ૦ : મંત્રન્યાપ કરે તો શાંતિ મળે અથવા કોઈક સંતને શરણે જવ. સંતની ઝૂપાથી પણ જલ્દી શાંતિ મળી શકે. પરમ તત્ત્વને શરણે જવ.

૫. પ્ર૦ : ગમે તે સંનેંગોમાં Adjust થવાય તો શાંતિ મળે. પુષ્પોની (સંનેંગોના) માળા બનાવવાની કુળા આવઢી જય તો શાંતિ પ્રાપ્ત થાય. તો આ કળા કેવી રીતે આવે ?

જ૦ : મનને અને સ્વભાવને કેળવો પડે...આ ખુખ અધદ્દ છે. કેટલાકના પગ ચુંધી પાણી આવે તો હાલેય નહીં. પગ જિંચો કરીને પાણી જવા હે અને કેટલાક પાણી દસ ફૂર દૂર હોય તો પણ જિભા થઈ જય...મતલબ સ્વભાવ કેળવો. આવનારી પરિસ્થિતિ માટે અત્યારથી અશાંત ન થાવ.

૬. પ્ર૦ : કોઈ પૂછે કે કેમ છો ! તો કહે શાંતિ છે ? વાસ્તવમાં શાંતિ છે કે નહીં તે જણ્ણવાનો ઉપાય ?

જ૦ : પોતાની કે પારકાની ? પોતાની શાંતિ તપાસવા આત્મનિરિક્ષણ કરો અને પારકાની શાંતિ તપાસવા મુખ્યાકૃતિના અભ્યાસથી આવડત કેળવો. પણ જરૂર ન હોય તો પારકાની આવી તપાસ કરવાની ટેવ ન પાડવી.

૭. પ્ર૦ : આપણું સારા કે નરસા 'મૂડ'નો અનુભવ થાય છે. નરસા મૂડને આધ્યાત્મિકતાથી દૂર કરી શકતો હોય તો ક્યા પ્રકારની આધ્યાત્મિકતા આચરણી ?

જ૦ : પ્રભુનું નામસ્મરણું ચાહું કરી દો. બસ પાંચ જ મીનીમાં મૂડ બદ્લાઈ જશે.

૮. પ્ર૦ : આજકાલ લેઢો શાંતિ મેળવવા દાર તથા નશીલી ગીજેનું સેવન કરે છે. આ મનોવિકાર સુધારવા સરળ આધ્યાત્મિક ઉપયાર બતાવો.

જ૦ : નશીલી ગીજેથી શાંતિ મળતી નથી. આ તો નેગેટીવ રસ્તો છે. તૈ તન, મન, ધન બધું પાયમાલ કરે. આવી વ્યક્તિને કોઈ પ્રક્રિયા સુધારી ન શકે. હા, કોઈ સાચો સંત જ આવી વ્યક્તિને સુધારી શકે.

૯. પ્ર૦ : તો આવી વ્યક્તિને સુધારવા માટે તેના હિતેચુંએ શું કરવું ?

જ૦ : ધ્યાનનું શરણું લેવું તથા કોઈક સંત સુધી આવી વ્યક્તિને સમજનીને લઈ જવી...પછી સંત પર છોડી દો. આવી વ્યક્તિ જે સુધરી જય તો અનેકોને સુધારી દેશે.

૧૦. પ્ર૦ : સામાન્ય માણુસ તકલીફ વખતે પ્રભુ-સ્મરણું કરે છે છતાંય તકલીફના વિચારો જતાં નથી તો શું કરવું ?

જ૦ : નામ-સ્મરણું કરો—એને જરાય છાડશો. નહિ. તકલીફના વિચારો આપોઆપ જશે પણ પૂર્ણ શ્રદ્ધારી નામ-સ્મરણું કરજો.

૧૧. પ્ર૦ : આપ કહો છો કે મંત્રનાયથી શાંતિ મળે છે તો આ શાંતિની પ્રક્રિયા સમજાવો.

જ૦ : મંત્રનાય કરો ત્યારે તમારા શરીરમાં ચોક્કસ સ્થાનો પરથી તરંગો પેદા થાય એને આ તરંગોથી જીજા (ધ્યેન્ક્રીક્સીટી) પેદા થાય. વળી જ્યારે પરમ તત્ત્વની સામે ધ્યાન ધરો ત્યારે આંદોલનો પેદા થાય એને આ આંદોલનો તમારા મગજ દારા અલાય જેથી શાંતિ પ્રાપ્ત થતી જય.

૧૨. પ્ર૦ : ઇન્સ્ટન્ટ શાંતિ મળે તેવો સરળ ઉપાય કહો.

જ૦ : અંતરના પ્રેમથી, સાચી શ્રદ્ધારી નામ-સ્મરણું.

૧૩. પ્ર૦ : નિયમિત રૂપે કરાતી ઉપાસનામાં વિધન આવે ત્યારે મન એચેન બને અથવા અશાંત થાય ત્યારે શું કરવું ?

જ૦ : આ આધ્યાત્મિક અશાંતિ ગણુંથ. આને વિધન ન ગણું, એને પ્રભુકૃપા ગણું. પણ આ સ્વીકારવા માટે પહેલાં મનને કેળવો...આવા વિચારોથી દૂર રહો.

૧૪. પ્ર૦ : એવું કહેવાય છે કે માનસિક શાંતિ એટલે 'Adjust everywhere'-સારાં કાર્યો કરતાં હોઈએ એને દીકાએ થાય, અથવા આપણું ઉદ્દેશે કરાવે તેવું વર્તન જોવા મળે ત્યારે શાંતિ રાખવી કે Adjust થવું શક્ય નથી લાગતું તો શું કરવું ?

જ૦ : સારું કાર્ય કરતાં હો તો સમાજ, સંસાર કે દુનિયા તેને સારું કહેશે નહીં. ખુલ્ખ વિધો આવે. તે સમયે પ્રભુસ્મરણું સાચે સહનશક્તિ કેળવો. તમે ઇરી તપાસો કે મારું કાર્ય સારું એને સાચું તો છે જ ને ? પછી ગભરાવ નહીં. પ્રભુકૃપા તમારી સાચે રહેશે.

૧૫. પ્ર૦ : શાંતિને ભૂમિ સાથે કે વાતાવરણ સાથે સંખ્યા છે ?

જ૦ : હું માનતો નથી. મનની એકાચતા હોય તો કચાંય પણ ક્રેક ન પડે.

૧૬. પ્ર૦ : કેટલાક સ્થળોનો ધાર્મિક કાર્યો માટે સ્વીકાર થતો નથી કેમકે ભૂમિમાં ઉદ્વેગ છે એમ કહેવાય છે તો આવું બને ?

જ૦ : ભૂમિ તો માતા છે. હું આમાં માનતો નથી ને મને અનુભવ નથી. પણ આવી ભૂમિ પર હું આવવા તૈયાર છું. હું તો ભૂતના ધરમાં જવા પણ તૈયાર છું.

૧૭. પ્ર૦ : કોઈક વ્યક્તિને અતિ ઉદ્વેગ વખતે લાક્ષે માર્યામાં આવે છે તો આવા પ્રહારથી શાંતિ મળી શકે ?

જ૦ : મને અનુભવ નથી. તેમજ આ પ્રક્રિયાનો હું ઉપયોગ પણ કરતો નથી. પણ સંવેદન-શીલતાના વાતાવરણમાં આવા અચાનક પ્રહારથી લાગણીશીલતા તૂટી જય અને સ્વસ્થતા પ્રાપ્ત થાય એવું બને. ગાંડાઓને અપાંતી Shock Treatment પણ આનો જ ભાગ હોઈ શકે.

૧૮. પ્ર૦ : ધણીવાર આઇસિક પરિસ્થિતિમાં જેમકે અચાનક મૃત્યુ, આક્સમાત્, ચોરી, વિયોગ વગેરેમાં માનસિક આધાત લાગે છે. કોઈક સંવેદનશીલ વ્યક્તિ ગાંડી થઈ જય અથવા આત્મહત્યા કરી બેસે, ત્યારે માનસિક સમતુલા જગવાઈ રહે એવી કોઈક પ્રક્રિયા ઘતાવો. અલખત આવા સમયે તમને પણ યાદ નથી કરી શકતા.

જ૦ : ઈષ્ટનું સ્મરણ શરણ થઈ જય તો બચી જવાય. માટે જ ઈશ્વર-સ્મરણ ક્યારેય ન ભૂલો. આદત પાડો કે દરેક પરિસ્થિતિમાં પ્રલુબ યાદ આવી જ જય.

૧૯. પ્ર૦ : જીવનમાં સ્નાતક બનવા સુધી ત્રિમાસીક, જ માસિક કે વાર્ષિક અનેક પરીક્ષાઓ આવે. આધ્યાત્મક જીવનમાં શાંતિના શીખર સુધી પહોંચવા માટેની પરીક્ષાઓ કઈ કઈ ?

જ૦ : પહેલું પગથીયું અહુમોદો ત્યાગ, બીજું સંતોષ, ત્રીજું સહનશક્તિ અને ચોથું બીજને મદ્દ કરવાની ભાવના.

(નવ સિદ્ધાંતોનો અમલ) એકેએક પગથીયું શ્રદ્ધા અને શરણાગાતરી ચલતા જાવ.

૨૦. પ્ર૦ : આપણે બીજને કઈ રીતે શાંતિ આપી શકીએ ?

જ૦ : આપણે કોઈનું અહિત ન કરીએ અથવા કોઈકની લાગણી દુલાય તેવું કોઈ પણ કાર્ય ન કરીએ એઠલી કાળજ રાખીએ.

૨૧. પ્ર૦ : ક્યારેક સંલેઝને આધિન તમારા સુધી ન અવાય ત્યારે એમ લાગ્યા કરે છે કે કદાચ શુરુકૃપા. એણી હુશે એટલે જ ત્યાં સુધી જવાતું નથી. આ સમયે મન વિહૃવળ બની જય છે. તો શું કરવું ?

જ૦ : તમારી પરિસ્થિતિ તમને રોકે છે. હું તો કોઈનેય રોકતો નથી. કોઈને પણ રોકવાતું માદં કાર્ય નથી. ગમે ત્યાં રહીને સ્મરણ કરો. પણ નિરાશ ન થશો. હિંમત ન હારશો.

૨૨. ૫૦ : કચારેક એવો અનુભવ થાય કે આજુથાજુ બહું જ શાંત છે. કોઈ અવાજ નથી અને બધાને જ આવો અનુભવ થાય તો એને નિરવ શાંતિ ગણ્યા? આજું બને?

૭૦ : વ્યક્તિગત આવો અનુભવ શક્ય છે પણ સમૂહને આવો અનુભવ થાય તો એ શું હશે તે વિચારનું પડે.

૨૩. ૫૦ : દૈલી શરખુાગતિ, આધ્યાત્મ શરખુાગતિ અને સંપૂર્ણ શરખુાગતિમાં પાછા પડીએ તો શું કરનું?

૭૦ : એક વાગ્યા પછી ગાડીને જોરથી ઉપાડવી પડે તેમ પાછા પડવા હો એવું લાગે તો અમણું જોરથી નામસમરણ રદ કરી દો... વધારે નામસમરણ કરે.

૨૪. ૫૦ : પરમ તત્ત્વ કેવી શાંતિ જાંબે છે?

૭૦ : પરમ તત્ત્વને તો શાંતિ છે જ. પણ આપણે કર્મો પ્રમાણે શાંતિ મેળવીએ છે. કર્મના ઇણથી શાંતિ કે અશાંતિ મળ્યા કરે. પરમ તત્ત્વને આપણે શું શાંતિ આપી શકીએ?

૨૫. ૫૦ : શાંતિ એટલે શું? ખલેલ રહિત કે ખુસ્તુમા?

૭૦ : આનંદમય સ્થિતિ.

૨૬. ૫૦ : કોઈકના મૃત્યુ વખતે લખીએ છીએ કે 'પ્રભુ સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે'... તો આ ચિર શાંતિ એટલે શું?

૭૦ : હું તો આવા કોઈ લખાણમાં માનતો નથી કારણ આ તો પ્રથા થઈ. ખરેખર તો આવા લખાણથી કોઈનેય શાંતિ મળતી નથી. એને તો કર્મના ઇળનું પરિણામ જ ભણે.

૨૭. ૫૦ : તો કોઈકના મૃત્યુ વખતે કેવું લખાણ લખવાતું આપ સૂચને છો?

૭૦ : પ્રભુ તારા શરખુભાં લેને.

૨૮. ૫૦ : મૃત્યુ પછી પળાતું મૌન કે પ્રાર્થના એને પહોંચે છે?

૭૦ : માતાજીને પુછું પડે. હું નથી માનતો કે મૃત્યુ પછી પ્રાર્થનાની અસર થતી હોય.

* * *

સદ્ગય શાંતિચિત્ત પૂજય શ્રી ગુરુદેવે આજની પ્રશ્નોત્તરીમાં શાંતિ પ્રાપ્ત કરવાના કેટથાય સુંદર રસ્તાએ દર્શાવ્યા. દુનિયાનાં દુઃખો લઈને પણ સતત પ્રસન્ન અને શાંત રહેતા ગુરુદેવની અસ્તિત્વાને શત શત વંદન...કાશ! આપણે આપણા દુઃખો સાથે પ્રસન્ન રહેવાની પ્રક્રિયા કેળવી શકીએ એવા આશીર્વાદની પૂજય ગુરુદેવ પાસે યાચના.

ॐ મા ॐ



આર્થ સંસ્કૃતિનું પુનરૂત્થાન....

તી.

૨૮-૫-'૬૫ રવિવારે લંડન-વેમ્પલીમાં શ્રી અમૃતભાઈ પોપટના નિવાસસ્થાને પૂજ્ય રાજયોગીજીના સાનિક્ષયમાં આધ્યાત્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશમાં ખાલી રીતે દેખાતું ખંડું જ સુખ, સમૃદ્ધિ હોવા છતાં ભીતરમાં તો દુઃખની અગ્નનિયાળા જ ભરેલી હોય છે. આનું કારણ શું? માણુસ સંપત્તિ મેળવે છે પરંતુ સંતતિ ગુમાવે છે. સુસંકારનો વારસો ખાળોમાં ઉત્તરોત્તર ચાલુ રાખવો હશે તો આર્થ સંસ્કૃતિને પુર્ણભૂવિત કરી જ પડશે, ધર્માચારણ કરવું જ પડશે.

આ પ્રસંગે પૂજ્યશ્રીએ પોતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું કે—

લંડન તણું આંગણું, શ્રદ્ધા તણું દરવાજે
રચાયો રપ્મો આધ્યાત્મિક સત્તસંગ
એ સત્તસંગ તણું રંગમાં રંગાયા લકુતજ્જનો
આજ પ્રેમ થકી આવકારે રાજ્યોગીને.

લંડનમાં હું ૧૯૮૧ની સાલમાં પહેલી વખત આવ્યો ને ત્યાર ખાદ દર વર્ષે આવતો રહ્યું છું. આ વખતે મારી લંડનની સુલાકાતનાં ૧૫ વર્ષ પૂરાં થાય છે. છેલ્ખાં પાંચ વર્ષથી ડિસેમ્બરમાં આવું છું આમ મારી લંડનની સુલાકાત ૨૦ વખતની થાય છે. અને આશરે લંડનની સુલાકાતના દ્વિસો ૪૦૫ દ્વિસની આસપાસ થાય છે.

માતાજીએ મને કે કાર્ય સોંઘું છે તે કાર્ય હું કરી રહ્યો છું. જો કે કાર્ય કરાવનાર માતાજી જ છે. હું તો એક માધ્યમ છું.

આ દેશમાં રહીને પણ તમો આ ક્ષેત્રે ડગ માંડતાં રહેશો તો તમારી ભાવિ પેઢી પણ તેનું અનુકરણ કરશે. એ રીતે તમો તમારી ભારતીય સંસ્કૃતિને જળવી શકશો. તેમનું સદ્ગારી જીવન ધી શકશો. ને એની મહેક તમારી આગળ પાછળના વાતાવરણને પણ સ્પર્શશે. જેથી તમારી સાયે ભીજો જનસમૃદ્ધય પણ જોડાશે.

આપણી આર્થ સંસ્કૃતિ ટકાવી. રાખવી હશે તો આપણે એ મુજબનું આચારણ કરવું પડશે. આપણી આર્થ સંસ્કૃતિમાં ખહેનોને, માતાઓને ખૂબ જ માન આપવામાં આવેલ છે. અને ખહેનોએ પણ તેમના પતિદેવો તરફથી પૂજ્ય ભાવની લાગણી દર્શાવિલ છે. આર્થ સંસ્કૃતિનું લગ્નથાંધન એ અજિન (દેવ)ની સાક્ષીએ થાય છે. તે contact ભગ્ન નથી. જેથી કરીને દરેક નારીએ પોતાના પતિદેવને રોજ સવારમાં જઈને પરે લાગવું જરૂરી છે. ને પતિદેવે પણ પોતે પત્નીનું રક્ષણ કરવું, માન આપવું ને

દરેક ક્ષેત્રમાં તેને સાથે રાખવી જોઈએ. માટે ને અત્ર ઉપસ્થિત છે તે દરરોજ સવારમાં પગે લાગતાં ન હોય તેમણે કાલે સવારથી જ જીઠિને પતિને પગે લાગવાનું શરૂ કરવું ને જે પતિને 'તુ'કારથી બોલાવતા હોય તો તે પણ બંધુ કરી દેવાનું.

ખાળડોએ પણ દરરોજ સવારમાં જીઠિને તેમનાં માતા-પિતાને પગે લાગવું જોઈએ અને આવું વર્તન દરેક ઘરમાં કરાશે તો પેઢીની પેઢીએ. સુધી આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે. પતનીએ પોતાનાં ખાળડોનાં દેખતાં જ પતિને પગે લાગવું, નેથી ખાળડોને પણ તે સંસ્કાર પડશે.

રામ લંકા ગયા હતા. બંધુ એમ માને છે કે રામ સીતાને દેવા માટે લંકા ગયા. પરંતુ રામે ધાર્યું હોત તો પોતે એકલા જ જઈને સીતા માતાને લઈ આવ્યાં હોત. અગર તો હનુમાનજીને આદેશ આપ્યો હોત તો તે પણ સીતા માતાને લઈ આવ્યા હોત. પરંતુ આધ્યાત્મિક રીતે અર્થધરણ કરીએ તો રામ રાવણુના અહ્ભૂતે તોડવા માટે ગયા હતા. રાવણ શંકરનો ભક્ત હતો. વિદ્વાન તથા રાજનીતિજ્ઞ પણ હતો, પરંતુ તેનામાં અહ્ભૂતો ભયંકર જ્વાળામુખી ભરેલો હતો. ને તે અહ્ભૂતા જ્વાળામુખીને નાથવા માટે રામ જતે લંકા ગયા હતા.

ન્યારે રાજયોગીનું વિદેશની ધરતી પર આગમન તમારામાં રહેલા અહ્ભૂતો નાશ કરવાનું અને હાલમાં પ્રવર્તતા માનવરૂપી રાક્ષસોથી બચાવવાનું કાર્ય માતાજીએ સોંપેલ છે.

રામ વખતની ભૌગોલિક પરિસ્થિતિમાં તેમણે તે મુજબતું કાર્ય કર્યું, હાલમાં પ્રવર્તતી પરિસ્થિતિ સુજય મારે કાર્ય કરવાનું છે, જે હું કરી રહ્યો છું:

ઓળ મહત્વની બાયત છે કે દરરોજ સાંજે સૂતાં પહેલાં તમો તમારાં ખાળડો સાથે એસી પાંચ મિનિટ, દસ મિનિટ આરતી સ્તુતિ વગેરે દરરોજ કરો. મેં આપેલા નવ સિદ્ધાંતો દરરોજ સૂતા પહેલાં વાંચો ને મનન કરો.

આજના હિને મારી માગણી એટલી જ છે કે આપણી આર્ય સંસ્કૃતિને જળવવા પ્રયત્ન કરો ને તે પ્રમાણે વર્તો.

ભીજું, તમારામાં રહેલા અહ્ભૂતે તોડો. તમને ખુદને તમારામાં શાંતિનો અનુભવ થશે. જીવનનો રાહ સરળ થતો જોઈ શકશો.

મારા આપં સર્વને આશીર્વાદ છે.



ધનિકોને લાલખતી

રાજ્યોગી નરેન્દ્રાલ

૨૫ ત્યાર સુધીમાં મારી સુલાકાતે લાઘો લોકો આવી ગયા, પણ દરેકને કોઈ આધિ, વ્યાધિ, ઉપાધિ કે ભૌતિક સ્વાર્થ હોય જ છે. કેટલાક આવે છે ને કાર્ય સફળ થતાં જ પાછા ચાલ્યા જય છે. ઇરી પાછી કોઈ સુરીયત આવે છે ત્યારે તેઓ મને શોધતા આવે છે. કેટલાક વળી નિયમિત આવતા રહે છે તેમાં પણ મોટા ભાગના માનવીઓને કોઈ ને કોઈ સ્વાર્થ રહેલો જ હોય છે. સેમાંથી એ જ ટકા લોકો એવા છે, જેઓને માતાજીમાં-ઈશ્વરમાં રસ છે, આધ્યાત્મિકતામાં રસ છે.

મારા સર્વેક્ષણ સુજય મારી પાસે ને ધનિક વર્ગ આવે છે, તેમાંથી અમુક યોતાના જેરે, સંપત્તિને આધારે સાંસારિક સામાજિક કાર્યો કરે છે, કરાવે છે ને સમાજમાં માન, મોભો, પ્રતિષ્ઠા, ઈજાત, આખર મેળવી ‘હું કંઈક છુ’ એવા અહેસાસથી જીવન જીવે છે. મને કહેતાં ખૂબ દુઃખ થાય છે કે તેઓ આધ્યાત્મિક કાર્યો પણ યૈસાના જેરે, સંપત્તિના આધારે કરવા તત્પર બને છે.

આવા ધનિકોને મારી લાલખતી છે કે, આધ્યાત્મિક ક્ષેત્રે માનવી યૈસાથી કોઈ કાર્ય કરવાની શકતો નથી. આધ્યાત્મિક કાર્ય કરવા માટે તો અદ્ધા, શરણાગતિ અને મંત્રના ખળની જરૂર છે.

એક ભાઈ ૧૯૭૬થી મારી પાસે આવતા હતા. તેમની આર્થિક અને શારીરિક પરિસ્થિતિ તે વખતે નાજુક હતી. તેમણે મારી પાસે આવી તેમની હુકીકત જણુંનો. મેં તેમને અદ્ધા અને શરણાગતિથી ગાયત્રી ઉપાસનાનો નિર્દેશ કર્યો હતો અને તેમના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શ્રેય માટે પ્રાર્થના કરી.

મેં માતાજીની શક્તિથી આધ્યાત્મિક રીતે તેમનો ખ્યાલ રાખવા માંડ્યો. મને ખ્યાલ આવી ગયો કે તેઓએ ખૂબ જ અદ્ધા અને શરણાગતિથી ગાયત્રીની ઉપાસના શરીરી છે અને બેદજનનીનાં પરમ પુનિત ચરણોમાં ઐસીને તેની કૃપા પ્રાપ્ત કરવાની પાત્રતા કેળવવા માંડી છે. તેમનાં અસત્ત કર્મેની નજીકના જ ભવિષ્યમાં અંત આવી જવાનો છે. સત્કર્મેના પુણ્યનો ઉદ્ઘય થવાનો છે. એને પરિણામે તેમની ઉન્નતિ હવે હાથવેંતમાં જ છે. તેમ માતાજીને વિનંતી કરીને હું તેમનામાં આધ્યાત્મિક ખળ જગાડ્યો. રહ્યો.

સમય વીતવા લાગ્યો. જેમ જેમ તેમના પુણ્યનો ઉદ્ઘય થતો ગયો તેમ તેમ તેમને સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થતા ગયા. સમય વહેતો ગયો. તેમ તેમ તેઓ સમૃદ્ધિની છોળોમાં આખા ને આખા ઝૂભી જવા લાગ્યા. સાથે જ તેમની ઉપાસના પણ ચાલુ જ હતી. તેમને માતાજીની કૃપાના એવા ને એઠલા બધા અનુભવો થયા કે એનું આલેખન કરવા ઐસીએ તો પાનાંની એક ખૂબ ભરાય.

સમૃદ્ધિના મહાસાગરમાં સહેલ કરતાં કરતાં કચારેક તો વિપરીત, પવન ઝૂંકાય કે વાવાઓઝૂં આવે તે સ્વાભાવિક છે.

માણુસ જીવનવાટમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતો હોય ત્યારે તેણે સંયમ કેળવી સાવધતા, સજાગતા કેળવી આગળ વધતા રહેવાની જરૂર છે, જેથી પલતની ભીણુમાં ગંભીર ન પડાય.

માણુસ જ્યારે ઈશ્વરને આશ્રમે જઈને જીવનનું સર્વ સુખ બોગવે છે ત્યારે ઈશ્વરને પણ તેને નાણી જોવાનું મન થાય છે. તેણે પોતાનામાં દાખ્યાંબેલી અદ્વા, શરણાગતિના બાંડાણું મન ઈશ્વરને પણ થાય છે ને તે લીલા આદરે છે...

૧૯૭૬થી ૮૮ સુધી માતાજીએ તેમનાં તમામ કાર્યોં અવિરત કર્યાં ત્યાર ખાદ અન્યું એવું કે તેમણે તેમની દીકરી મારે એક મુરતિયો શોધ્યો. તેની સાચે દીકરીને પરણાવવાનું નક્કી કરીને તેઓ મારી પાસે આશીર્વાદ લેવા આવ્યા. તેમણે મારા આશીર્વાદની યાચના કરી એટલે મેં હકીકતને ધ્યાનમાં લીધી તો મને જણાયું કે તેમની દીકરી મારે આ મુરતિયો ચોણ્ય નથી. આથી મેં તેમને આ લગ્ન રોકવા જણાવ્યું. મુરતિયાની અપાત્રતા વિશે પણ મેં તેમને નિર્દેશ કર્યો. મારા આ નિર્દેશથી તેઓ ખૂબ વ્યથિત થઈ ગયા. તેમની સામાજિક પ્રતિષ્ઠા આડે આવતી હતી. મેં તેમને સમજાવ્યા, પણ તેમના ગણે એ વાત ન જિતરી. તેઓ વ્યથિત હદ્દે પાછા ફર્યા.

તેમની વ્યથાથી મને પણ ધણું દુઃખ થયું, પણ હું શું કરું? માણુસે વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં તો શીખવું જ જોઈએ ને! ઈશ્વરની મરળનો સ્વીકાર ન કરીએ તો તેની શરણાગતિ સ્વીકારેલી ન કહેવાય. પણ ધણું ઉપાસકોને આ સત્ય સમજાવું નથી તેનું મને ખૂબ બાંદું દુઃખ છે.

તેમની વ્યથા જોઈ મેં માતાજીને તેમના શ્રેષ્ઠ મારે પ્રાર્થના કરી.

યોડો સમય એમ ને એમ વહી ગયો.

એક દિવસ તેમના ભિત્ર મને મળવા આવ્યા. મેં તેમની ખાદર પૂછી. તેમણે મને જણાવ્યું:

“ ગુરુદેવ, હું તેમને મળીને જ અહીં આવ્યો છું. મેં જ્યારે તેમને મારી સાચે અહીં આવવા જણાવ્યું ત્યારે તેમણે મને કહ્યું કે,

“ જ્યાં સુધી મારી દીકરીનાં લગ્ન ન થાય ત્યાં સુધી હું ગુરુદેવને મળીશ નહિ. એવી મેં પ્રતિજ્ઞા કરી છે.”

તેમના શખ્સી સાંભળી મનો દુઃખ આશ્ર્ય થયું. મનો થયું કે આ તો મારી સામે નહિ, પણ માતાજી સામે બંડ છે. માયે તેમને કચાંથી કચાં લાણી મૂક્યા છે તે તેઓ ભૂલી ગયા? માણુસ ઈશ્વર સાચે પણ ડેટલી હુદે કૃતદની બની શકે છે?

જીવનના મહાસાગરમાં કચારેક આવા વિપરીત પવનનો એક સુસવારે આવે ત્યારે તો અદ્વા અને શરણાગતિના જેરે સંયમ દાખ્યાંબેલી સ્થિર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ તેને બદ્દલે પોતાના રક્ષક, જીવન-વિધાતા એવા પરસેશ્વર સામે જ મનુષ્ય બંડ પોકારી જડે છે?

આ પરિસ્થિતિ ઉચ્ચિત નથી.

મનુષ્યના સ્વાર્થની કોઈ પરિસીમા નથી.

ગુણ્યાત્મિક કેડી, એપ્રિલ, '૯૬]

૨૫

મારી પાસે આવતાં લોકોને હું તેમના પ્રશ્નો-સમસ્યાઓ પરતે માર્ગદર્શન આપું છું તેમાં ભારો કોઈ મતાચહુ હોતો નથી. મને માતાજી તરફથી જે આદેશ, પ્રેરણા અને સંકેત મળે છે તે હું આગન્તુકને સમજાવું છું પણ આગન્તુકને અપેક્ષિત-મનોવાંછિત માર્ગદર્શન કે ઇની નથી મળતું ત્યારે તે નિરાશ થઈ જય છે એટલું જ નહિ, તેની શક્તા અને શરણાગતિ પણ ઉગી જય છે. આ મનોદ્દશા આધ્યાત્મિક દાખિયે હું ઉચ્ચિત નથી સમજતો. વ્યક્તિ જ્યારે બાળક બનીને મા પાસે જય છે ત્યારે મા તેના શ્રેયનો-હિતનો જ્યાલ રાખે જ છે તે પ્રત્યેક ઉપાસકે યાદ રાખવું જરૂરી છે. ઈશ્વર ઉપાસકનું અહિત થવા દેતો નથી. એ સત્ય પણ કેમ વિસરી જવાય છે તે મને સમજાતું નથી.

અતે મેં દીકરીના જે લગ્ન રોકવા જણાવ્યું તે દીકરીના હિતમાં જ હતું ને! માતાજીનો સંકેત હતો ને! અને માતાજીના સંકેતોથી-તેની લીલાઓથી તેઓ કચાં અપરિયિત હતા! છતાં આ વલણું?! શું ઈશ્વર માણુસનું ભૌતિક અને સાંસારિક સુખ મેળવવાનું જ માત્ર સાધન છે? શું માણુસ ભૌતિકતા અને સાંસારિકતાની પ્રાપ્તિ માટે જ ઈશ્વરની શરણાગતિ સીકારે છે? મને ખૂબ હુંઘ થાય છે ઉપાસકેના આવા વલણુંથી. ઈશ્વરની કૃપાના, તેની શક્તિના અગણિત અનુભવો મેળવ્યા પણ માનવી ભૌતિકતા અને સાંસારિકતાને મોહ છોડી શકતો નથી. એને આધ્યાત્મિકતામાં ઈશ્વરોપાસનામાં, તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં કેમ કોઈ રસ નથી જગતો કે દ્વિલયસ્પી થતી નથી!

નિઃસ્વાર્થભાવ કેળવવો ખૂબ દુષ્કર છે...

એકવાર જ્ઞાનગોપનિમાં તેમણે આ પ્રસંગ વર્ણિતો હતો. આ સમય પ્રસંગના વર્ણન દરમ્યાન પૂ. શ્રી રાજ્યોગી નરેન્દ્રજીના સુખ પર જ્ઞાનની જે ગાઢ રેખાઓ વર્તાવી હતી એ જ્ઞાનિ શ્રી નરેન્દ્ર દ્વારા નામના કોઈ મહાપુરુષની નહોતી, પણ એ જ્ઞાનિ મા વેદજ્ઞનની સ્વયં અનુભવતાં હોય તેમ સ્પષ્ટ અનુભવાયું. એટલું જ નહિ, આ સમય અધ્યાત્મિક પણ ચુંચુંદેવ શાસ્ત્રીજી નહિ, પણ મા ગાયત્રી સ્વયં આવી મોખતાં હોય તેમ અનુભવાયું. કચાં મંદ અને ભિત્તભાષી શાસ્ત્રીજી અને કચાં તેમની વાહુનો આ જુસ્સો! આ સમય દરમ્યાન સમય વાતાવરણ મા ગાયત્રીની સ્વયં ઉપસ્થિતિની પ્રતીતિ કરાવતું હતું. પૂ. શ્રીતું સમય દર્શન, તેમના અવાજનો રણુકો, તેમના હાવભાવ, સમય ખંડનો પરિવેશ, વાતાવરણ, પૂ. શ્રીના સમસ્ત અસ્તિત્વમાંથી ઉપસતી આભામાં વેદજ્ઞનની મા ગાયત્રીની ઉપસ્થિતિની અનુભૂતિ થતી હતી. એ કેવળ અનુભૂતિનો જ વિષય રહ્યો છે.



નવરાત્રીની અષ્ટમીએ.... પ્રત્યક્ષ ઉપસ્થિતિનો અહેસાસ કરાયો।

નવરાત્રીની અષ્ટમીએ ‘શ્રદ્ધા’ કુટિરમાં મા ભગવતી પ્રત્યક્ષ તેના બાળ પૂજય રાજયોગીજી સાથે ગરાયે રમવા પધારશે જ તેવી હું શ્રદ્ધા સાથે સમગ્ર માહેલને માણુવા, ગરાયે ધૂમવા અને દર્શન કરવા માટે લોકોની ભીડ જમી હતી.

ગરાયાની રમજટ જમી હતી. ગુરુદૈવ હિંચકે બિરાજમાન હતા. કુટિરનું સમગ્ર વાતાવરણ આને દિવ્ય અને ભવ્ય લાગતું હતું.

પૂજય રાજયોગીજીએ સ્વરચિત ગરાયા ગવરાય્યા. પૂજયશ્રી ગરાયાની રચના કરતી વેળાએ ચોતાનો ભાવ વ્યક્ત કરતાં જણાવે છે : “તા. ૨૧-૪-૬૫ સવારે પાંચ વાગે ટોરન્ટોમાં ધનસુખભાઈ ભતીના ઘરે હું પૂજા પરવારી બેઠો હતો ત્યારે હું એકાએક ભાવ સમાધિમાં દૂધી ગયો અને ગરાયાના શબ્દો પેપર પર અંકાઈ ગયા. બહેનજીની સમક્ષ પ્રથમ વખત જ એ ગરાયો મેં ગાયો, ત્યાર પછી મેં કચારેય આ ગરાયો ગાયો નથી. ગરાયાના શબ્દો છે : “લાગ્યો લાગ્યો રે મને માતનો પ્રેમ લાગ્યો.”

લાગ્યો લાગ્યો રે મને,
માતનો પ્રેમ લાગ્યો....(૨)

માત વિના તરસે આ ધરતી,
આવીને તૃપ્ત કર આ ધરતીને....લાગ્યો।
પ્રસાદ ધરાવું કળીના લાડુનો
એલચી કેસર મહીં પધરાવું....લાગ્યો।

ખીચડી ને માખણું કેરાં લોજન આરોગાવું
કરસાણુમાં સેવ-ઉસળ પીરસાવું....લાગ્યો।

તરત જ ખીંને ગરાયો પૂજયશ્રીએ ગવરાય્યો :

આજ આઠમ કેરી રાત....

આજ આઠમ કેરી રાત,	સોણે શાખુગાર તને શોખતા,
નોંધાં તારી હું વાટ	કુમ કુમ વણ્ણી તારાં પગલાં,
તું આવ રમવા રે....રમવા રે	તું આવ રમવા રે....રમવા રે
સોણે શાખુગાર તને શોખતા,	મા-ખાગની પ્રીત નથી ખાનગી
કુમ કુમ વણ્ણી તારાં પગલાં,	શી હુરકત છે જહેરમાં
તું આવ રમવા રે....રમવા રે	તું આવ રમવા રે....રમવા રે

આધ્યાત્મિક કેઢી, અપ્રિલ, '૬૬]

ભાવતાં લોજન કેરો થાળ ધરાવું	હૃદય કમળનાં પુંષો ચઢાવું....લાગ્યો।
પ્રેમ કેરું મા આસન બિછાવું	આસન પર તુજને પધરાવું....લાગ્યો।
હુસ્ત થકી હું તુજને જમાડું	હુસ્ત તું મુજને જમાડને....લાગ્યો।
પ્રસાદ તું મુજને જમાડને....લાગ્યો।	સાથે બેસીને વાતો કરાવને
સમગ્ર થયે ચાલી તું જાને	સમગ્ર થયે ચાલી તું જાને
અવકાશ મળે આવી તું જાને....લાગ્યો।	અવકાશ મળે આવી તું જાને....લાગ્યો।

આંદો છું બહાર હું ચોકમાં
તારા મનગમતા ચોખાકમાં
હું આવ રમવા રે....રમવા ૩૦

આ બાળહઠ છે મારી

તારા વિના મારે નથી રમવું
હું આવ રમવા રે....રમવા ૩૦
માડી તારાં પગતાં આવિયાં
રજથોગી તારો હરખાયો
હું આવ રમવા રે....રમવા ૩૦

“આ ગરબો છુટ્ટા નોરતે સવારે ભારાઈ ગયો, ગવાઈ ગયો.” પૂજયશ્રીએ જણાવ્યું.

પાંચમી નવરાત્રિએ રાતે માતાજી સ્વસ્થમાં પદ્ધાર્યા. અને મને જણાવ્યું કે, “ચાલ તૈયાર થઈ જો.” હું તૈયાર થવા જતો હતો ત્યાંજ માતાજીએ લાલ રંગના કંઈની પાયજલમો મને આપ્યાં અને પહેરવા જણાવ્યું. હું તૈયાર થઈ ગયો. માતાજી આગળ અને હું પાછળ, મારી ઇમમાંથી નીકળી માંદિરમાં આવ્યાં. હું માંદિરમાં માતાજીના ફોટોને આદિત મુજબ પગે લાગ્યો. ત્યાંથી અમે ચોકમાં આવ્યાં.

માતાજી અને હું ચોકમાં મધ્યમાં ઉભાં હતાં. માતાજીએ એક તાળી પાડી. તેની સાથે જ અવકાશમાંથી ચાર ચારના ચુપમાં સોણ દેવકન્યાએ લાલ રંગની સાડી પરિધાન કરેલાં ચાર દિશાઓમાં ગોઠવાઈ ગયાં. દિવ્ય સંગીતની સુરાવલિ તેની જલે જ અગોયર ઇપે રેલાઈ રહી હતી.

સંગીતના તાલે માતાજી અને મેં દેવકન્યાએની સાથે ગરબે ધૂમવા માડ્યું. દેવકન્યાએ તેમના સ્થાને જ ગૂમતી હતી. માતાજી અને હું જુદી જુદી પાંચ મુદ્રાઓમાં દેવકન્યાએની વચ્ચમાં, અંદર અને બહારની ખાજુ વિશુદ્ધ દિશામાં ધૂમતાં હતાં.

થોડી વાર પછી સંગીતની સુરાવલિ બંધ થઈ ગઈ. માતાજીએ એક તાળી પાડી, દેવકન્યાએ અવકાશમાં અદસ્ય થઈ. આર્થિકિતા હું જાગી ગયો. આનંદ વિલોર હું કંચાંય સુધી એસી રહ્યો. પાણી પીને તાહસ્યતાને માણુંતો માણુંતો ફરીથી નિદ્રાધીન થઈ ગયો.

આ ડ્રેસ મેં પહેરો છે તેવો જ ડ્રેસ મેં માતાજી સાથે ગરબો ધૂમતાં પહેરો હતો.”

આને ભક્તોની સમક્ષ સ્વસ્થમાં માતાજી અને દેવકન્યાએની સાથે જે રીતે ગરબે ધૂમ્યા હતા તેની તાહસ્યતા રજૂ કરવા અને સમય પ્રસંગની દિવ્યતાને માણવા માટે ભક્ત સમુદ્દરાને વિનંતી કરતાં જ સમય ચોક એકદમ ખાલી કરવામાં આવ્યો. ભક્તથેનોમાંથી જ તૈયાર કરવામાં આવેલ સોણ દેવકન્યાએ ગુરુદેવ અને માતાજીના ઇપમાં પીની (પૂજય ગુરુદેવની દીકરી) ચોકમાં ગરબે ધૂમી સ્વસ્થ સૃષ્ટિને ખડી કરી દીધી હતી.

ગાયકવુંદ અને સર્વ ઉપસ્થિત ભક્તજનો ધડીભર તો આત્માનંદમાં લીન બની ગયાં હતા.

તે જ રાતે ગરબાનો પ્રોઆમ પૂરો થતાં સહુ ભક્તો વિભરાયા પછી પૂજયશ્રીની ઇમમાં ચાર પાંચ ભક્તો ઉભા હતા તેમની સાથે વાત કરતાં કરતાં પૂજયશ્રીએ શું જેયું ? તેમના જ શાંદોમાં સાંભળાએ :

“મેં માતાજીના ફોટોમાં એ હાથ કંઈક આપવાની મુદ્રામાં જેયાં. હું નેપક્કાન પલંગ પર મૂકીને દોડ્યો અને જોએ ધરીને જલો રહ્યો. મારા જોયામાં એક એક કરીને નવ મોતી માતાજીએ પથરાવ્યા અને માતાજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિનો અહેસાસ સહુને કરાવ્યો.”



સૂતરના તાંત્રણે

‘સૂરત ટેક્ષાઈલ માર્કેટ’માં ચોન્યાયેલો ગાયત્રી મહાયજા

એ. સ. ૧૯૬૫ના ડિસેમ્બરની ખીજુ તારીખે સૂરતમાં ‘સૂરત ટેક્ષાઈલ માર્કેટ’માં પૂ. રાજ્યોગી નરેન્દ્રાળની નિશ્ચામાં ૧૧ કુંડી ગાયત્રી મહાયજાનું આપોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. શ્રીએ રજૂ કરેલું વકાલ્ય અને પ્રસ્તુત છે. તેમણે જણાવ્યું હતું :

સૂરત તણી ખરતી પર, સૂરત ટેક્ષાઈલ માર્કેટમાં,
રચાયેલી ગાયત્રી યજા, આવો બાધુઓ વહાલા,
પૂજન કરીએ પરમ તત્ત્વનું, પરમ તત્ત્વે જ અભ્યું.
તેનો અહોભાવ પ્રદર્શિત કરીએ.

આપણે એને કશું આપવાને શક્તિમાન નથી પણ એણે ને આપ્યું છે તેનો અહોભાવ પ્રદર્શિત કરીએ છીએ :

યજ તણી આહૃતિમાં અર્પે આહૃતિ દુર્ગણો તણી
કરો સંકલ્પ પવિત્ર થાવાનો, સંસારમાં સુગંધ રેલાશો.

યજની આહૃતિ આપી, પણ શરીરમાં જે દુર્ગણો છે તે દુર્ગણાની આહૃતિ આપો. આને સંકલ્પ કરો કે પવિત્ર થવું છે ને પવિત્ર થનવું છે તો સંસારમાં પણ સુગંધ રેલાશો.

પરમ તત્ત્વ અર્પે માનવ દેહ, માનવી અર્પે કપડાં માનવ દેહને
સરૈદે સૂતર તણો તાંત્રણો, વણ્ણાઈને બને કાપડ.

પરમ તત્ત્વે તો માનવ દેહ આપ્યો છે, પણ ટેક્ષાઈલ માર્કેટ કપડાં આપે છે.

માનવીએ વણ્ણાઈ જાએ સૂતર સરીખા
જગતમાં ઐકચ સાધી શકશો, પ્રગતિનાં સોપાન સર કરી શકશો.

નેમ સૂતરનાં તાંત્રણો વણ્ણાઈને કાપડ બને છે તેવી રીતે તમે બધા વણ્ણાઈ જાએ. તમે માનવીએ એક થઈને રહેશો તો ઐકચ સાધી શકશો. દુનિયામાં જે કંઈ હાંસલ કરવું હશે તે કરી શકશો.

હું દર વખતે દોહરાવતો આવ્યો છું કે તમે તમારા પડ્દરિપુને નાથો – નેવાં કે કામ, કોધ, લોભ, મોહ, મદ, મતસર – આ છ આપણું દુસ્મનો છે. એને મહાત કરવાના છે. ખીજું મન, વચન, કર્મથી પવિત્ર થનવાનું છે. પરમ તત્ત્વની અદ્વા અને શરણ્યાગતિ સ્વીકારો. મેં આપેલા નવ સિદ્ધાંતોનું પાલન કરો. માનવતા વત કરો. જે આઠલું કરશો તો માનીલો કે તમે જગતમાં જીતી ગયા અને પરલોકને પામી ગયા.

જગતમાં દરેક દરેક માનવીને કાપડની જરૂરિયાત રહે છે. કપડાં વગરનો માનવી જગતમાં સ્વીકાર્ય નથી. માનવી કપડાં થકી દેખાવમાં આઝ્કડક લાગે છે. ને સૂતરના તાંત્રણામાંથી કાપડ થનવું તે તેનો પુરુષાર્થ છે. નેથી સૂતર આપણું સતત પુરુષાર્થ કરવાનું શીખવે છે. માટે પુરુષાર્થ કરતા રહો. સફળતા તમારા આંગણે આવી જાલી રહેશો.

તમે મને યાદ નહિ કરો, કારણ કે હું તો નનો છું. તમે યજને॥૭ યાદ કરશો॥

તમે ઘેર જશો, યજને યાદ કરશો.

યજ તણી જવાળાઓ આંખવા આકાશનેં જીંચે અઠે

મુજ આશિષ આપ સર્વ સક્રણતાનાં શિખરોને આંખતાં રહો.

આંખતાં રહો, આંખતાં રહો,

અગોચર રહી રાજયોગી આશિષ અર્પણ રહો.

મારી હાજરી હોય કે ન હોય. પણ મારી આશિષ તમારા બધાંની સાથે જ છે. મારા જેવું કંઈ કામ પડે તો મને અંતરથી યાદ કરજો.

મુજ સરીખું કંઈ કામ, મુજને અંતરથી યાદ કરશો

લાગશો સર્વ હુઃખ દર્દ તમારાં.

મને યાદ કરો ને તમારાં હુઃખ દર્દ ભાગે નહિ તો તે હીલાં કહેવાય :

હીલા હોય જે હુઃખ દર્દ, આશરો મેરા લુલનજી ને આહેશ તણો.

મારા આપ સર્વને આરીંવાદ છે.”

સમય દ્વિસ દરમ્યાન કોઈક અનોખા વાતાવરણની અનુભૂતિ થતી હતી. આ યજના ત્રણ-ચાર આયોજકો સિવાય યજમાં ભાગ લેનાર ટેક્ષાઈલ માર્કેટના તમામ વેપારીઓ, કર્મચારીઓ, પૂ. શ્રી રાજયોગી નરેન્દ્રાણનાં કાર્ય અને વ્યક્તિત્વથી અપરિચિત હતા, છતાં સૌના દ્વિલાં પરાકાર્યની ઉત્કટ અભિલાષા હતી. ટેક્ષાઈલ ઉદ્યોગમાં અવારનવાર આવતી આપત્તિઓમાં વેદજનની મા ભગવતીની સહાયની યાચના હતી. અને તેથી જ ટેક્ષાઈલ માર્કેટ જેવા પાર્થિવ સંકુલમાં ગાયત્રી યજની જવાળા-એને પ્રદીપીત કરી-કરાવી, ગાયત્રી મંત્રાચ્ચારથી સમય વાતાવરણને સભર કરી દીધું, જેથી અલોકિક આહુલાદકતાની જે અનુભૂતિ થઈ. તેનાથી સૌના અંતર, તત, મન, પ્રાણ પરમમાં તરબોળ-તન્મય થઈ ચૂક્યાં હતાં. યજના આરંભકાળથી જ વેપારીઓ ભાઈઓ અને તેમનાં કુદુંબીઓ યજ સ્થળે એકત્ર થઈ ગયાં હતાં. આરંભથી પૂર્ણાંહુતી સુંધી સૌંદ્રી સતત હાજરી આપી હતી. વેપારીઓ અને સૌ કર્મચારી ભાઈ-અહેનોનો ઉત્સાહ અનેરો હતો. એક અનોખા પરિવેશની એ અનુભૂતિ હતી.

યજની પૂર્ણાંહુતિનો સમય પણ અલોકિક હતો. પૂ. શ્રી રાજયોગી નરેન્દ્રાણના હસ્તે યજની પૂર્ણાંહુતી થઈ હતી. તેમના વરદ હસ્તે જ પૂર્ણાંહુતિનું શ્રીદેવ હોમાયું હતું. આ ક્ષણે દરમ્યાન પૂ. શ્રીનું સમય ૩૫ અલોકિક ભાસતું હતું. તેમની આંખો બંધ હતી. તેમના ચહેરા પર ગુલાણી આભા પ્રસરી ગઈ હતી. કચારેક કચારેક તેમના હોઠ દ્વારી જતા હતા. જણે તેઓ માતાજી સાથે વાતો ન કરતા હોય! તેમનું મસ્તક વારેવારે ઝૂંઝૂ જતું હતું, એ વાત સ્પષ્ટ કરતી હતી કે માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ હતી જ અને તેઓ સ્વયં માતાજીનાં દર્શન કરતાં હતાં. યજના આચાર્યના મંત્રાચ્ચાર, સ્તોત્રપદન કે ઋગ્યા-ગાનના ધ્વનિના ગુંબલરવ સિવાય સમય વાતાવરણ અને સૌ સ્તખ્ય હતાં — માના ધ્યાનમાં, તેની ઉપસ્થિતિના પ્રભાવમાં, તેના પ્રતાપમાં.

યજ કુંડાની રચના સીધી લીટીમાં કરવામાં આવી હતી. સમય યજનું આયોજન પણ ખૂબ જ સરળ હતું.



[આધ્યાત્મિક કેઠી, એપ્રિલ, '૬૬

ફ્રેન્ડ્સ પૂજય રાજ્યોણી નરેન્દ્રલુનો અમેરિકાનો કાર્યચઙ્ગ ફ્રેન્ડ

મે - જૂન, ૧૯૬૬

તારીખ	દિવસ	સમય	સ્થળ	આયોજન	ટેલિક્રેન નંબર
૧૦-૫-૬૬	શુક્રવાર	—	—	—	—
૧૧-૫-૬૬	શનિવાર સાંકે	૬.૮	કોલેનીયા, ન્યુ ઝર્સી	દેવભાગ પટેલ	૬૦૮-૩૮૮-૨૪૬૧
૧૨-૫-૬૬	રવિવાર	૬.૮	"	"	"
૧૩-૫-૬૬	સોમવાર	—	—	—	—
૧૪-૫-૬૬	મંગળવાર	૬.૮	ધાર્કયુવિલેજ, ઈલીનોઈસ	કાંતિભાઈ પટેલ	૭૦૮-૬૮૦-૦૮૬૪
૧૫-૫-૬૬	યુધવાર	૬.૮	"	"	"
૧૬-૫-૬૬	ગુરુવાર	૩.૫	ડેરીયન ઈલીનોઈસ	શિલ્પ અચ્ચવાલ	૭૦૮-૬૧૦-૦૦૬૨
૧૭-૫-૬૬	શુક્રવાર	૬.૮	ઇવાન્સવીલ ધન્ડીયાના	સુરેશભાઈ પટેલ	૮૧૨-૪૨૪-૩૫૬૬
૧૮-૫-૬૬	શનિવાર	૬.૮	શેલ્ફીવીલ ટેનિરી	બાલુભાઈ પટેલ	૬૧૫-૬૮૪-૩૧૦૧
૧૯-૫-૬૬	રવિવાર	૬.૮	બાન્સવીલ ન્યોર્જિયા	ઈશ્વરભાઈ પટેલ	૭૭૦-૩૫૮-૧૭૦૦
૨૦-૫-૬૬	સોમવાર	૬.૮	શાર્લેટ નોર્થકેરેલીના	પુષ્પાભેન પટેલ	૭૦૪-૫૨૭-૪૨૧૮
૨૧-૫-૬૬	મંગળવાર	૬.૮	"	"	"
૨૨-૫-૬૬	યુધવાર	—	શાર્લેટથી વર્જનીયાખીય	—	—
૨૩-૫-૬૬	ગુરુવાર	૬.૮	વર્જનીયાખીય વર્જનીયા	કારીએભાઈ પટેલ	૮૦૪-૪૨૮-૨૮૨૨
૨૪-૫-૬૬	શુક્રવાર	૬.૮	વીલીયમ્સાર્ગ વર્જનીયા	"	૮૦૪-૨૨૬-૪૮૩૩
૨૫-૫-૬૬	શનિવાર	—	—	—	—
૨૬-૫-૬૬	રવિવાર	૬.૮	યુનીયનસીટી ન્યુજર્સી	રતીલાલ મિશ્રી	૨૦૧-૮૬૫-૭૨૮૨
૨૭-૫-૬૬	સોમવાર	૬.૮	"	"	"
૨૮-૫-૬૬	મંગળવાર	૬.૮	"	"	"
૨૯-૫-૬૬	યુધવાર	૬.૮	"	"	"
૩૦-૫-૬૬	ગુરુવાર	૬.૮	"	"	"
૩૧-૫-૬૬	શુક્રવાર	૬.૮	કોલેનીયા ન્યુજર્સી	દેવભાગ પટેલ	૬૦૮-૩૮૮-૨૪૬૧
૧-૬-૬૬	શનિવાર	૬.૮	"	"	"
૨-૬-૬૬	રવિવાર	૬.૮	ન્યૂયોર્ક,,	દીનેશ કાયસ્થ	૭૧૮-૮૪૩-૧૪૩૬
૩-૬-૬૬	સોમવાર	—	—	—	—
૪-૬-૬૬	મંગળવાર	—	—	—	—
૫-૬-૬૬	યુધવાર	—	ન્યુ ઝર્સીથી લાંબ	—	—

આધ્યાત્મિક કેઢી, અપ્રિલ, '૬૬]

ફુઅમેરિકાનો કાર્યયજ્ઞ : ઓગસ્ટ-૧૯૬૬ ફુ

૪-૮-૬૬	સોમવાર	—	લંડનથી ન્યૂ જર્સી'	—	—
૬-૮-૬૬	મંગળવાર	૫.૮	કોલોનીયા ન્યૂ જર્સી'	દેવભાગ પટેલ	૬૦૮-૩૮૮-૨૪૬૧
૭-૮-૬૬	ખુદ્ઘવાર	૫.૮	"	"	"
૮-૮-૬૬	ગુરુવાર	૫.૮	"	"	"
૯-૮-૬૬	શુક્રવાર	૫.૮	ઇલ્કટ્રો વિલેજ ઇલીનોઈસ	કાંતિલાલ પટેલ	૭૦૮-૬૮૦-૦૮૬૪
૧૦-૮-૬૬	શનિવાર	૫.૮	"	"	"
૧૧-૮-૬૬	રવિવાર	૫.૮	કોલોનીયા ન્યૂ જર્સી'	દેવભાગ પટેલ	૬૦૮-૩૮૮-૨૪૬૧
૧૨-૮-૬૬	સોમવાર	—	ન્યૂ જર્સી'થી લંડન	—	—

ફુ ઇંગ્લેન્ડનો કાર્યયજ્ઞ : ઓગસ્ટ-૧૯૬૬ ફુ

૧૩-૮-૬૬	મંગળવાર		લેસ્ટર		
૧૪-૮-૬૬	ખુદ્ઘવાર		લેસ્ટર		
૧૫-૮-૬૬	ગુરુવાર		લેસ્ટર		
૧૬-૮-૬૬	શુક્રવાર	૪.૭	લેસ્ટર	પ્રદીપ વડેરા	૦૧૧૬-૨૩૫૪-૬૧૧
૧૭-૮-૬૬	શનિવાર	૪.૭	"	"	"
૧૮-૮-૬૬	રવિવાર	૪.૭	"	"	"
૧૯-૮-૬૬	સોમવાર				
૨૦-૮-૬૬	મંગળવાર				
૨૧-૮-૬૬	ખુદ્ઘવાર				
૨૨-૮-૬૬	ગુરુવાર				
૨૩-૮-૬૬	શુક્રવાર	૪.૭	વેન્થલી લંડન	અમૃતલાલ પેટ્રા	૦૧૮૧-૬૦૨-૩૦૨૬
૨૪-૮-૬૬	શનિવાર	૪.૭	"	"	
૨૫-૮-૬૬	રવિવાર	૪.૭	"	"	
૨૬-૮-૬૬	સોમવાર	૧.૨	કોયટન લંડન	નાયાતિઅન પરમાર	
૨૭-૮-૬૬	મંગળવાર				
૨૮-૮-૬૬	ખુદ્ઘવાર				
૨૯-૮-૬૬	ગુરુવાર				
૩૦-૮-૬૬	શુક્રવાર		લંડનથી મુંબઈ		
૩૧-૮-૬૬	શનિવાર		મુંબઈથી અમદાવાદ		

નાંદુ : ગ્રામાભની વધુ વિગત સંપર્ક કરવો :

અમેરિકા માર્ટ : દેવભાગ પટેલ - ૬૦૮-૩૮૮-૨૪૬૧

ઇંગ્લેન્ડ માર્ટ : પ્રદીપ વડેરા - ૦૧૧૬-૨૩૫૪-૬૧૧

નિત્ય-સ્મરણુ

રાજયોગી હે ! દિવ્યયોગી હે !
માત્યોગી હે ! નાથ્યોગી હે !

ગ્રલાત :

નિત્ય ભમ ઉરે આપ હો ઉદ્ધય, નરેન્દ્રમય સકલ નવપ્રલાત હો,
સુરભિમય ઉષા પુનિત મંગલા, નાથ સ્મરણુથી થાય ઉજવલા....રાજયોગી૦

મધ્યાહ્ન :

હો પ્રભર એવિ મધ્ય વ્યોમમાં, આપનું સ્મરણુ રોમ-રોમમાં,
પૂર્ણ તેજ તવ હો હૃદય વિશે, લોચનો ઠરે નાથ ત્યાં હીસે....રાજયોગી૦

સંદેશા :

પઞ્ચિમે હળી સૂર્ય આથમે, ચરણુંદના નાથની ગમે,
પરમશક્તિને એ જ પ્રાર્થના, મુજ હૃદય વસો માત વત્સલા....રાજયોગી૦

રાત્રિ :

રાજનીએ સહા નાથ રક્ષણે, નયનમાં સપન આપના હણે,
તિમિરધન લક્ષે હોય શર્વરી, સુક્રમ આપના સાનિંધ્યથી ભરી....રાજયોગી૦

નિત્ય :

અધર પર રહે નામ-માધુરી, નયનમાં રમે ઇપ-માધુરી,
હૃદયથી વહે પ્રેમ-માધુરી, પૂર્ણ નાથને માધુરી લીલા....રાજયોગી૦

— મુંનલ દવે

સ્ફુર્તિ

* તા. ૬-૫-'૮૬ થી તા. ૧૦-૬-'૮૬ સુધી પૂ. ગુરુદેવનો કાર્યયજ હોવાથી તા. ૬-૫-'૮૬ થી
તા. ૧૬-૬-'૮૬ સુધી 'નીલોષા' બંધ રહેશે. તા. ૧૭-૬-'૮૬થી 'નીલોષા' પર મુલાકાત ચાલુ થશે.

* તા. ૫-૮-'૮૬ થી તા. ૨૮-૮-'૮૬ સુધી પૂ. ગુરુદેવનો અમેરિકા - ઇંડિયાનો કાર્યયજ હોવાથી
તા. ૨-૮-'૮૬ થી તા. ૧-૮-'૮૬ સુધી 'નીલોષા' બંધ રહેશે.
તા. ૨-૯-'૮૬ થી 'નીલોષા' પર રાખેતા મુજાય પૂ. શ્રીના મુલાકાત ચાલુ થશે.

* ઇંડિયાના પ્રોથમ માર્ગ શ્રી પ્રદીપ વડેરા - ફેનાનં. (૦૧૧૬) ૨૭૪૪-૬૧૧નો સંપર્ક સાધવો.

* તા. ૩૦-૭-'૮૬ ને મંગળવારના રોજ ગુરુપૂર્ણિમા છે. સવારે ૮થી બ્યોરે ૧ વાગ્યા સુધી
પૂ. શ્રીના દર્શનનો લાભ મળશે.

સ્થથા : પી. જી. મહેતા મેમેરિયલ હોલ, શાંકર આશ્રમ સામે, હિવાન અલ્લુભાઈ માથમિક શાળા
સામે, નારાયણનગર રોડ, રાજીતગર બસ સ્ટેન્ડ પાસે, પાલડી અમદાવાદ-૭

* તા. ૭-૮-'૮૬ના રોજ પૂ. ગુરુદેવ રાજયોગી નરેન્દ્રજીનો જગતહિંદુસ છે. સવારે ૮થી
બ્યોરે ૧ વાગ્યા સુધી પૂ. શ્રીના દર્શનનો લાભ મળશે.

સ્થથા : પી. જી. મહેતા મેમેરિયલ હોલ, શાંકર આશ્રમ સામે, હિવાન અલ્લુભાઈ માથમિક
શાળા સામે, નારાયણનગર રોડ, રાજીતગર બસ સ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭

* મારા જીવનનાં નવ સૂત્રો *

- (૧) દાટમાં સમુદ્ભૂતી શ્રદ્ધા અને શરણાગતિ રાખવી. (૨) નિઃસહાયને સહાય કરવી.
 (૩) દુઃખીઓનાં હિંદિનાં આંસુ લુછવાં. (૪) ડોઈની દાર્યા કરવી નહિ. (૫) ડોઈની સાથે વિશ્વાસથાત કરવો નહિ. (૬) પરનિનદાથી દૂર રહેવું. (૭) પુરુષાર્થને અભ્રતા આપી સતત કાર્યશીલ રહેવું. (૮) નિઃસ્વાર્થ સેવા કરવી. (૯) અહુમનો ત્યાગ કરવો.

— રાજ્યોગી નરેન્દ્રલુ

૭૭, 'શ્રદ્ધા', ચોગેશ્વરનગર સોસાયટી, બાંડુ પાસે, અંજલિ સિનેમા પાછળ,
 વાસણ્ણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૭



પૂ. રાજ્યોગી નરેન્દ્રલુની મુલાકાત

- * આધિ, વ્યાધિ, ઉપાધિથી વ્રસ્ત કોઈ પણ વ્યક્તિ જાતિ, જાતિ કે સમુદ્ધાયનાં બંધનો સિવાય, વિનામૂલ્યે પૂ. રાજ્યોગી નરેન્દ્રલુની મુલાકાત લઈ, માર્ગદર્શન મેળવી શકે છે. પૂજયશ્રીની પ્રત્યક્ષ મુલાકાત શક્ય ન બને તો પણ દરરોજ અડધો કલાક પરમ શક્તિ મંત્રનાપને જીવનના અનિવાર્ય દેનિક કાર્યક્રમમાં વણી લેને.

મુલાકાત સ્થળ : 'નીલોધા' બંગલો, વ્રિમૂર્તિ સોસાયટી, ગવર્નર્સેન્ટ પાંચ બંગલા પાસે,
 શુલમોર ફ્લેટ્સ પાછળ, શુલમાર્ચ ટેકરા, અમદાવાદ-૧૫.

સમય : બપોરના ૧૨-૦૦ થી ૨-૦૦ (૧૦૧ વ્યક્તિને મુલાકાત)

શાન્દિ-રવિ તથા જાહેર રાજના હિવસે બંધ.

- * પૂ. રાજ્યોગી નરેન્દ્રલુ આપના પત્રો વાંચે છે, પરન્તુ લેખિત જવાબ પાડવતા નથી.
- * શારીરિક-માનસિક તકલીફવાળા દરેક વ્યક્તિએ સ્વચ્છ કરેલી એ ચમચી મેઠી અને એ ચમચી રાઈ એક મહિના માટે અભિમંત્રિત કરાવવા સાથે લાવવાં જરૂરી છે. પાણીની બાટલી સાથે લાવવી જરૂરી નથી.

— ૪૪ — ૪૫ — ૪૬ — ૪૭ —